

# વિદ્યા

પક્ષીનિરીક્ષકો વર્ષ્યેનો સેતુ - ત્રૈમાસિક

શાર્દ ૨૦૦૭



પચામર્શક : લાલબિંહ રાઓલ

સંપાદક : ડૉ. બનુલ નિવેદી

## પંથીપુરક પરિચય શ્રેણી - ૪



સ્વ. ધર્મકુમારસિંહજીના પુસ્તકનો પરિચય ‘વિહંગ’ ના સંસ્કરણ અંક ૧ રમાં વાચકોને કરાયો. સરખાસ્વભાવ અને સમાન શ્રોષ ધરાવનારાઓમાં મૈત્રી ક્રોળે. સંસ્કૃતમાં સુભાષિત છે તે, સમાનશીલ (સરખાસ્વભાવ) વસ્તનેસુ (શોખ) સપ્ચયુ (મૈત્રી) પક્ષનિરીક્ષણના સમાન શોખને કરણે આપણા બધાં વચ્ચે એક પ્રકારની મૈત્રી છે. એક મિત્ર કાંઈક રસપ્રદ બાબત કે વસ્તુ જોઈ હોય તો તે અન્ય મિત્રોને જણાવ્યા સિવાય તેનાથી રહેવાતું નથી. ગુજરાતના તેમજ ભારતના બે સમર્થ પક્ષનિરીક્ષણ (સ્વ. શ્રી ધર્મકુમારસિંહજી અને શ્રી લવકુમાર ખાચર) એ પોતાને પક્ષનિરીક્ષણ અને પક્ષનિરીક્ષણની કેવા કેવા રસપ્રદ અનુભવો થયા અને કેવો આનંદ અનુભવો તેમાં આપણને ભાગીદાર બનાવવા માટે ‘Sixty Indian Birds’ (પ્રકાશક: પબ્લિકેશન ડીવીઝન, નવી દિલ્હી) લખ્યું. તે પ્રસિદ્ધ થયું, એપ્રિલ ૧૯૭૭ રૂમાં.

લેખકોનો હેતુ નવા નિશાળિયાઓને પક્ષનિરીક્ષણ કરાવવાનો જ નથી, પણ યુવા પેડીને આપણી પક્ષનિરીક્ષણમાં રસ લેતા કરવાનો છે. વાચક કીકીકી કશનો પક્ષનિરીક્ષણ છે, એટલું તેમને ગૃહિત છે. તેવાઓને માટે પુસ્તક લખાયું છે. પ્રવેશકમાં સ્વ. વડપ્રધાન શ્રીમતી હિંદ્રા ગાંધીએ સંકેપમાં પક્ષનિરીક્ષણને બિરદાર્યાયું છે.

લેખકોએ પાદેલાં સાદાં અને રંગીન પક્ષનિરીક્ષણ છિપ્પન આદ્ય લેટમાં આયાં હોવાથી પુસ્તક વધારે આકર્ષક બન્યું છે. જે જમાનામાં આ ફોટોઓ પડાયા છે તે જમાનામાં આજના જેવા આધુનિકતમ કેમેરા અને શક્તિશાળી ‘ગ્રૂમ લેન્સ’ ન હતા. પ્રાય સાધનોથી સુંદર પરિણામ મેળવવામાં લેખકોની કસોટી થઈ જતી.

પંખીઓના ફોટો પાડતી વખતે કેવી કેવી સાવચેતી રાખવી અનિવાર્ય છે, તે લેખકો પ્રસ્તાવનામાં તેમજ પુસ્તકમાં પ્રસંગોપાત જરૂરાવતા જ રહ્યા છે. પક્ષનિરીક્ષણ માટે તેના ફોટો જેટલું જ મહત્વ પક્ષીનું છે. ના, ફોટો કરતાં પક્ષી જ વધારે મહત્વનું હોવું જોઈએ. પક્ષીઓ બહુ સંવેદનશીલ પ્રાણીઓ છે. તેમને ખલેલ ન પડે અથવા તો અનિવાર્ય એટલી ન્યૂનતમ ખલેલ પડે તે વાત ફોટોની જોતા હોય તેમ તેમને ક્યારેક પાનો ચાડવવા કે પક્ષીના ફોટો પાડવા માટે જે કોઈ હળપાન આવાંપાછાં કર્યા હોય તે પૂર્વવત્તુ કરી જ દેવા જોઈએ. તેમ નહીં થાય તો પક્ષીની, તેના હીંદાની કે બધ્યાંની સલામતી જોખમાશે.

પક્ષીઓ કેવાં સંવેદનશીલ હોય છે તેનો એક દાખલો આપું. હું જમનગર હતો ત્યારની વાત છે. એક મિત્ર પોતાના મકાનમાં ભારણા પાસે મધુમાલતી વેલ ઉછેરેલ. એક શક્કરખોરાની માદા તેમાં રાતવાસો કરવા રોજ આવતી. મિત્રની

સાતક પુત્રી આ જોયા કરતી. માદા જ્યાં રાતવાસો કરતી તે જગ્યા તેને અસલામત લાગી. તેને વધારે સલામત કરવા તેણે, તે જગ્યાની આસપાસનાં પાન એક દિવસ સમાનમાં કર્યા અને શક્કરખોરાની રાહ જોતી બેઠી. યથા સમયે, માદા આવી. પોતાની રૈનબોસેરાની જગ્યા આમતેમ જોઈ અને રાતવાસો કર્યા વિના જતી રહી ! માનવે કરેલ ફેરફાર તેને સુરક્ષપ્રદ ન લાગ્યો. પક્ષીફોટોન્ફાફરે આવું આવું ધ્યાનમાં રાખવાનું હોય છે.

૩૦-૩૫ વરસ પહેલાં અત્યારના જેવા શક્તિશાળી ‘ગ્રૂમ લેન્સ’ ન હતા. માણામાંના પંખીઓના ફોટો પાડવા માટે ગોપન-કોટી (Hide) અનિવાર્ય હતી. હીંડાં સેવતા કે બચ્યાં ઉછેરતા પક્ષીને ખલેલ ન પડે તેનું સતત ધ્યાન રાખીને શક્ય એટલી નજીક કોટી ગોઠવવાની રહેતી. માત્ર દોઢાં મીટર જેટલા અંતરેથી માણામાંના પંખીનું નિરીક્ષણ કેટલું રોમાંચક હોય છે, તે આપણને જણાવ્યા સિવાય લેખકોને સંતોષ થતો નથી. આવા ફોટો પાડવા તે એક જાતનું તપ હતું. ફોટો જોઈને આપણે બોલી ઉઠાયે: “વાખ, કેવો સરસ ફોટો છે !”, પણ તે પાડવા માટે ફોટોગ્રાફરને ક્યારેક કલાકોની તપશ્ચર્યા કરવી પડી હોય છે.

પંખીઓના ફોટો પાડતાં લેખકોએ જોખેલ રસપ્રદ બનાવો વિશે વાંચતાં આપણને આનંદ અને ક્યારેક આશ્ર્ય થાય. સાંસાગરે મારેલ કબૂતર, શાહી ઝુમ્સ કેવી રીતે ઉદાવી ગયો અને સાંસાગર યુગલ કેવી અસહાયપણે તે જોઈ રહ્યું, તે પ્રસંગ અવિસ્મરણીય છે.

એક વાર માણાનો ફોટો પાડવા માટે ગોપન-કોટી ગોઠવવામાં લેખકો એટલા તલ્લીન થઈ ગયેલા કે, અગડા ધ્યાનની તેમની પ્રવૃત્તિ જોઈ રહ્યા હતા તેનો તેમને ધ્યાલ ન રહ્યો. કોટી સંતોષકારક રીતે ગોઠવીને લેખકો હજુ નિરાતનો શાસ લે તે પહેલાં તેમની નજીર સામે જ બે કાગડા માણામાંના બન્ને હીંડાં ઉદાવી ગયા ! લેખકો લાચારીથી આ જોઈ રહ્યા.

બીજા એક પ્રસંગે, બે કાગડા એકબીજાના પગમાં પગ ભરવીને ઝગડવા લાગ્યા. તેમના સંખ્યાબંધ નાતીલા ગોળ ટેણે વળીને કુસીંદગલ જોતા હોય તેમ તેમને ક્યારેક પાનો ચાડવવા કે ક્યારેક તેમનો ઝુરિયો બોલાવવા લાગ્યા. આ તાદૃશ વર્જન વાંચતાં વાચક મલકી ગયા વિના ન રહે. આવા કેટલાય રસિક પ્રસંગો આ પુસ્તકમાં વાંચવા મળે છે.

પુસ્તકની ભાષા સરળ, નિરાંબરી અને આસ્વાદ છે. લાલસિંહ રાઓલ સી-૨, હાઇસ્પેક્ટર, ‘ટાઇમ્સ ઓફ ઇન્ડીયા’ પ્રેસ રોડ, અચાર્ય પટેક, અમદાવાદ-૫૧

## સૂવિ

પુજારથી પદ્ધતિઓ - ૪  
Sixty Indian Birds

લિંગાબલોડન  
કેટલાંક ભયસ્થાનો

૫



નિર્બીજાણ નોંધ	૫
- કચ્છમાં સરેર સુરખાબ	૬
- કલોગુરુ સર્કીટ કેમેરાનો પ્રયોગ	૧૦
- ભૂકુંપની ઈડા પર અસર નાની કંકણસારના માળા	૧૩ ૧૯

સાદ્દન વોચ	૨૧
------------	----

ગાય પર જાપતો	૨૨
--------------	----

પસસેતુ	૨૩
--------	----

Stoliczka's Bush Chat	૨૫
-----------------------	----

મ.કુ.હિમતશિહળણી ડલમે ઉજના પ્રજનનની ચોક્કસ ઝતું છે?	૨૮
---	----

એઠ અભિપ્રાય	૩૨
-------------	----

Call of Indian Birds	
----------------------	--

આવરણ	
------	--

વન અભાબીલ (Crested Swift)	
---------------------------	--

તસ્વીર : ભૂપણ પંચા, રાજકોટ	
----------------------------	--

ઘેણા ચિત્રો	
-------------	--

ડૉ. બંદુલ ત્રિવેદી (તસ્વીરના આધારે)	
-------------------------------------	--

## સંપાદણીય



તા. ૨૨-૬-૨૦૦૧ના રોજ

જીમનગરથી ૧૦ કિ.મી. દૂર આવેલા ખીજડિયા પક્ષીઅભયારણ્યમાં જવાનો મોડો મળ્યો. વિશેષમાં શ્રી ઉદયભાઈ વોરાનો સંગાથ હતો. કચ્છના અભયાતના કિનારે, ભરતી-ઓટ વિસ્તાર (intertidal zone)માં આવેલું અને આશરે ૬૦૦ હેક્ટરમાં વિસ્તરેલું આ અભયારણ્ય તેની એક ખાસ વિશેષતાને લીધે અજોડ છે. જમીન સુધારણા (reclamation) માટે ભૂતપૂર્વ રાજ્યાં દ્વારા બનાવાયેલા બે પાળાને લીધે અહીં પાળાની એક બાજુ ન્દી-વરસાદનું મીઠું પાણી એકૃતું થાય છે અને બીજી તરફ દરિયાની ભરતીનું ખારું પાણી. આથી દરિયાકંઠે તથા અંતરિયાન મીઠાં પાણીનાં જળાલાવિત ક્ષેત્રો ઉપર, એમ બને જગ્યાએ જોવા મળતાં પાણીનાં પક્ષીઓ અહીં જોવા મળી શકે છે. યાયાવર પક્ષીઓના પ્રવાસ-માર્ગ ઉપર આવેલું આ અભયારણ્ય, આમ બહોળું પક્ષીવૈવિધ્ય ધરાવે છે. કાદવ ખૂંદનારાં પક્ષીઓ (waders) ઓળખવાની જાત - કસોટી કરવી હોય તો અહીં પહોંચી જતું !

અમારી મુલાકાતના દિવસે યાયાવર બતકો ઓછી હતી. કાદવ ખૂંદનારાં પક્ષીઓ ઘણાં હતાં, જેમાંનાં થોડાં ઓળખ્યાં અને થોડાં પડતાં મૂક્યાં ! 'કેવલટેવ પક્ષી અભયારણ્ય', ભરતપુરની જેમ અહીં પણ, પાળે પાળે ચાલો અને બને તરફ વિસ્તરેલાં પાણીમાંનાં પંખીઓ માણસી રહે. મુખ્ય પાળામાંથી પાણીની અંદર જતી કેડીઓ પણ છે, જેમાંની કેટલીક, ગાંડા બાવળની નિરંકુશ વૃદ્ધિથી ખેડી શકાય તેવી નથી. એક પગથી ચોખ્યી કરેલી હતી. ગાંડા બાવળની સમાંતર હાર વચ્ચેથી પસાર થતી આ પગથીને છેડે અમે નીલગાયનો નર જોયો. પ્રશાંત વાતાવરણ હતું. એક દૂધરાજે આ સુંદર વનરાજિની ચાડી ખાધી. મીઠા પાણીની ક્યારીઓમાં ચિયા પુજળ હતાં. ત્યાં જ બેસી રહીએ અને ચિયામાં છુપાયેલી પાનબગલી (Bittern) અજાણતાં-બેફિકરાઈથી બહાર નિકળે તેની રાહ જોઈએ, તેમ થતું હતું.

મુખ્ય પાળા પર આવી, અમે પાળે પાળે વૉચટાવર સુધી ગયા. વૉચટાવર ઉપરથી જ અમે પાણીની વચમાં, ગાંડા બાવળનાં વૃક્ષો પર ફેલાયેલી વિશાળ માળા - વસાહત જોઈ. આશરે ૮-૧૦ જાતિનાં પક્ષીઓના સેકડોની સંખ્યામાં માળા હતાં. વિશેષ આકર્ષણ હતું નાની કંકણસાર (Glossy Ibis)ના માળાનું. 'દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન'ના નાયબ વનસ્પતિક, શ્રી સુરેશભાઈ જાનીએ સૌ.પ્રથમ ૮મી



## વિઠંગ



વર્ષ - ૪ સંબંધ અંદર ૧૪ શારદ ૨૦૦૧

પરામર્શક	સંપાદક
લાલસિંહ રાઓલ ડૉ. બંદુલ ત્રિવેદી	
સંપાદક મંડળ	
પી.એસ.દક્કર, ડૉ. આર.બી.બલર, કે.ડી.વૈષ્ણવ	
પત્રવ્યવહાર:	
૧૮/૪૧૪, સત્યાગ્રહ ધારણા, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫	

લવાજમ: નિશુલ્ક (શુભેચ્છા ફાળો આવકાર્ય - 'વિઠંગ' ના નામે ચેક/ફ્રાફ્ટ અથવા મ.ઓ.થી.)

પ્રકાશક: લાલસિંહ રાઓલ, સી-૨, હરિઓમ એપાર્ટમેન્ટ, ટાઈભ્સ ઓફ ઇન્ડિયા પ્રેસ પાસે,

જીવરાજ પાર્ક, અમદાવાદ-૩૮૦૦૫૧.

મુદ્રક: ડૉ. બંદુલ ત્રિવેદી, મુદ્રશસ્થાન: 'શારદ પ્રકાશન', ૫, સનપોર્ટ કોમ્પ્લેક્સ, ગુરુકુણ ટાવર સામે, અમદાવાદ-૩૮૦૦૫૨.

સાટે. ના રોજ આ માળા-વસાહતમાં, નાની કંકણસારના બે માળાની નોંધ કરી હતી. અમે તેનો એક માળો જોયો, જેમાં બે બચ્ચાં હતાં. એક નાની કંકણસાર આસપાસં ઉડતી હતી અને અમારી હાજરીથી દૂર રહેતી હતી.

અમને કેટલાક પ્રક્રિયાઓ ઉઠ્યાં. અન્ય પક્ષીઓના આટલી મોટી સંખ્યામાં માળા અને નાની કંકણસારના માત્ર બે જ કેમ? આમારી નાવ પસર થવા છતાં બીજાં પક્ષીઓ માળા પર બેસી રહ્યાં હતાં, જ્યારે નાની કંકણસાર અમારી હાજરીથી કેમ વિશેપ પામતી હતી? એક જ વાલીની હાજરી કેમ?

નાની કંકણસાર અંશતઃ શિયાળું મુલાકાતી છે અને અંશતઃ સ્થાનિક છે. અત્યાર સુધી ગુજરાતમાં તેના પ્રજનનની બે જ નોંધ હતી, જે બંને કંઈમાં હતી. સૌરાષ્ટ્રમાં તેના પ્રજનનની આ સૌ પ્રથમ નોંધ કહેવાય.

આ સિવાય, અભયારણ્યમાં, અન્ય જગ્યાએ ગાંડા બાવળ ઉપર જ અમે કાળીડોક ઢોક (Blacknecked Stork)નો એક માળો જોયો. દૂરભીનથી જોતાં માળો વિશાળ લાગ્યો, જેમાં એક પક્ષી બેઠેલું દેખાતું હતું. શ્રી જાનીના જળાય્યા અનુસાર, જામનગરની આસપાસ કાળીડોક ઢોકની પાંચથી છ જોડ જોવા મળે છે. વરસેક પહેલાં શ્રી રાજેશ શાહે જામનગર શહેરની બહારના વિસ્તારમાંથી લીધેલી કાળીડોક ઢોકની તસવીર 'વિહંગ' ને મોકલી હતી. વડાતલાવ, સાબરમતી નદીના મુખપ્રદેશ પાસે પણ કાળીડોક ઢોક નિયમિત જોવા મળે છે. કાળીડોક ઢોક અત્યારે 'nearly threatened' શ્રેણીમાં મુકાયેલી જાતિ છે. કાળીડોક ઢોકની ઉપસ્થિતિ કે પ્રજનનની નોંધ 'વિહંગ' ને તથા 'બી.એન.એચ.એસ.' ને અચૂક મોકલતા રહો એ આવશ્યક છે. તેવું જ નાની કંકણસારનું છે. માળા-વસાહતોમાં અન્ય પક્ષીઓની સાથે નાની કંકણસારની હાજરી વિષે પણ આપણે તપાસ કરતા રહેવાની છે.

બપોર પછી અમે ખીજડિયા અભયારણ્યના જાંબુડા વિસ્તારમાં ગયા. ત્યાં મોટી સંખ્યામાં જળહળ (Indian Skimmer) છે, એવાતું શ્રી જાનીને સવારે જ કરી હતી અને જોવાની તાંબોવલી હતી. સૂર્યસિત પહેલાંનો સાંજનો એકાદ કલાક અમે જળહળના સાનિધ્યમાં ગાળ્યો. જળહળ લગભગ ૨૦૦ની સંખ્યામાં હતાં. જાડી-ગંખરાની અાડશનો ઉપયોગ કરી અમે ધીરે ધીરે નજીક જતા ગયા

અને લગભગ પચીસેક મીટર દૂરથી જળહળની લાક્ષણિકતાઓ નિરાંતે માણી.

ખીજડિયા ખાતેના આ થોડા કલાકોની મુલાકાતમાં અમે એક-બે પાનપણાઈ (Marsh Harrier) અને એક મત્સ્યભોજ (Osprey) સિવાય અન્ય કોઈ શિકારી પક્ષીઓ જોયાં નહીં.

પાછા વળતાં રાજકોટમાં, આણુ-રૂમની પાસે ચિયાવાળા વિસ્તારમાં પીળી પાનબગલી (Yellow Bittern) જોઈ. આ વર્ષે અહીં, શ્રી અશોક મશરૂમે તેના માળાની નોંધ કરી છે. તેમણે તેનો ત્યજાયેલો માળો પણ અમને બતાવ્યો. બે વટેમાર્ગું પ્રવાસી (passage migrant) પક્ષીઓની પણ અમે નોંધ કરી. ન્યારી-૧ તેમ પાસે અશોકબાઈએ ટપકીલો માખીમાર (Spotted Flycatcher) બતાવ્યો. ખાસ કોઈ લાક્ષણિકતાઓ વિનાનું, મોટી ઝૂટી (Warbler) જેવા દેખાવનું આ પક્ષી, તેના વર્તન ઉપરથી માખીમાર (Flycatcher) કુળનું છે, તેમ તરત જણાઈ આવે. કપાળ ઉપરનાં ટપકાં કરતાં ગળા ઉપરની રેખાઓ વધુ ધ્યાનાકર્ષક લાગ્યી. બીજું વટેમાર્ગું પક્ષી, કાશ્મીરી ચાષ (Kashmir Roller), પ્રવાસ દરમિયાન વચ્ચે વચ્ચે વીજળીના તાર ઉપર બેઠેલો જોયો.

તા. ૩૦-૮-૨૦૦૧ના રોજ કાર્તિક શાસ્ત્રી અને ખમીર સાથે નળસરોવર ગયો ત્યારે પણ કાશ્મીરી ચાષની હાજરી પૂરી. નળસરોવરની મુલાકાતે જઈએ ત્યારે પક્ષીનિરીક્ષણનો આનંદ સાણાંદથી જ શરૂ થઈ જાય. સાણાંદ, મુખ્ય બજારના રસ્તાની બાજુનાં વૃક્ષો પર નિયમિત માળા-વસાહતો જોવા મળે છે. પાણીનાં સ્થાનિક પક્ષીઓની માળા બનાવવાની જગ્યાની પસંદગી કચારેક નવાઈ પમાડે તેવી હોય છે. સાણાંદની નશ્ચકમાં એતું કોઈ મોટું જળાશય નથી. વૃક્ષોમાંના ઘણાં નાનાં કે મધ્યમ કદનાં છે. બજારનો રસ્તો અમદાવાદ-વિરમગામ ધોરીમાર્ગ હોવાને લીધે વાહનબ્યવહાર અને માળાસોની અવરજનવર સતત ચાલુ જ હોય છે, તેમ છતાં આહી નિયમિત રીતે માળા-વસાહતો જોવા મળે છે. આમલીના એક વૃક્ષની ટોચ પર અમે ધોળીડોક ઢોક (Whitenecked Stork)નો એક માળો જોયો, તેમાં તથા આસપાસનાં અન્ય એક-બે વૃક્ષોમાં નાનાં તથા વચ્ચે

બગલા (Little and Median Egret)ના ઘણા માળા હતા.

સાંધારથી નજસરોવરના રસ્તે ૨૦ ક્રિ.મી.ના અંતરે એક ખેડાયેલા ખેતરમાં એક સાથે ૪૪ સફેદ ઢોક (White Stork) જોયા. આ સુંદર પક્ષી મોટી સંખ્યામાં જોવાનું ખૂબ રોચક લાગ્યું. આ વર્ષે પાછેતરો વરસાદ નહીંવંતુ રહેવાથી, પાણી ભરેલાં ખેતરો ખાસ જોવા મળ્યાં નહીં, નહીં તો તેમાં સેકડેની સંખ્યામાં કાળીપુંછ ગડેરા (Blacktailed Godwit), ટીલિયા (Ruff and Reeve) અને નાની કાંકણસાર (Glossy Ibis) જોવા મળી જાય. નજસરોવરમાં પાણી સારું એવું હતું એટલે કિનારેથી ખાસ કોઈ પક્ષી દેખાયાં નહીં અને રવિવારની એ સવારે, અન્ય કોઈ પક્ષીનિરીક્ષકો પણ ન દેખાયા. અંતરરાષ્ટ્રીય ખ્યાતિ પરાવતા આ જીતિ મહત્વના જળખાવિત ક્ષેત્રની, મોટી સંખ્યામાં પક્ષીનિરીક્ષકો મુલાકાત લેતા હોવા જોઈએ, એવો વિચાર મનમાં આવી ગયો. યુવાન વર્ગમાં પક્ષીનિરીક્ષણનો શોખ જાગૃત કરવામાં હજુ ક્યાંક ખોટ છે, તેમ લાગ્યું અને તેની જવાબદારી આપણે સૌઓ સ્વીકારવાની છે, એવો

અહેસાસ પજા થયો. સ્થાનિક પ્રકૃતિમંડળો, પક્ષીનિરીક્ષણની પ્રવૃત્તિ માટે વધુ સક્રિય બને તે ઈચ્છાનીય છે. સાથે સાથે, નવા નિશાળિયા અને પીઠ પક્ષીનિરીક્ષકો વચ્ચે વિચાર અને અનુભવોનો વિનિમય વધે તેવી વ્યવસ્થાની પજા જરૂર છે. પ્રત્યેક શહેર કે મોટા કસબામાં પક્ષીનિરીક્ષકોનું એક સ્થાનિક મંચ હોવું જોઈએ.

આ વખતે અમે ‘વિહંગ’ના કદ અને સ્વરૂપ બદલ્યાં છે. માત્ર નવીનતા ખાતર પજા થોડા ફેરફાર આવશ્યક છે! ‘ગીધ પર જાપતો’ વિભાગ અંતર્ગત ગીધની અવલોકન નોંધ તથા અન્ય માહિતી આપતા રહીશું. ઝડપથી લુપ્ત થતી પક્ષીની આ જીતિ વિશે વધુ જાગૃતિ કેળવાય તથા તેના સંરક્ષણ માટે આપણે સામૂહિક રીતે વધુ કટિબદ્ધ થઈએ તે હેતુથી આ નવો વિભાગ શરૂ કર્યો છે. આશા છે સૈને એ ગમશે.

‘વિહંગ’, સૌ વાચક મિત્રોને દિવાળીની શુભ કામનાઓ પાઠવે છે.



## વિહંગાવલોકન

### કેટલાંક ભયસ્થાનો

આધુનિક રહીશોની પક્ષીઓ સાથેની મૈત્રી રહી નથી. તેમનાં રહેઠાણની આસપાસમાં, ચોખ્યું અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવી રાખવાના તેમના વલણને લીધે ચકલીનું પીઠું કે હોવાએ લાવેલી જણી હવે કચરો ગજાય છે, જેનો તેઓ ખુલ્લેખામ વિરોધ કરે છે. પરંપરાગત રીતે પક્ષીઓને આશ્રય, રહેઠાણ અને ખોરાક પૂરો પાડતાં વૃક્ષો કૃપાય છે. ખરેખર, આધુનિક શહેરીકરણ પક્ષીઓ માટે તો પ્રતિકૂળ છે જ, સાથે સાથે માણસો માટે પજા !

શુંહું આપણી, ઉત્સાહી પક્ષીનિરીક્ષકોની પલટનને પૂછી શકું, “તેમણે તેમની અડોશ-પડોશમાં ક્યારેય રેવીટેવી (Barn Owl) જોયું છે? તેમના વિસ્તારમાં ચીબરી (Spotted Owlet)ની વસ્તી કેટલી છે?” આપણે આપણાં સામાન્ય પક્ષીઓ ઉપર નજર રાખવી અત્યંત આવશ્યક છે. જો તેઓ સલામત હશે તો જ આપણે પક્ષીજગત માટે સ્વસ્થ, સાનુકુળ પર્યવરણ હોવા વિષે છાતી ઠોકીને દાવો કરી શકીશું. એક

### લવકુમાર ખાયર

(અનુ: ડૉ. બનુલ નિવેદી)



સમયની વ્યાપક અને બહુસંખ્યક પક્ષીની જીતિ એકદમ લુપ્ત થવાના આરે આવી જાય અને આપણે માણું પક્ષીને બેસી જઈએ એવું ન થવું જોઈએ. ગીધની મુશ્કેલીઓનો આપણે પહેલેથી વિચાર કર્યો હોત તો, આજે પક્ષીવિદોને દાસ્યાસ્પદ રીતે જે કરણ ભૂમિકા ભજવવી પડે છે, તેમ ન કરવું પડત !

મને લાગે છે, કોઈ વિશિષ્ટ પક્ષીની જીતિ માટે વધુ પડતી વિંતા કરવાને બદલે આપણે અગત્યનાં જળખાવિત ક્ષેત્રો, ધાસનાં વીડો તથા જંગલ વિસ્તારોને ચૂંટી, તેમને નુકસાન ન થાય તે ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. વનખાતા તરફથી કે બિનસરકારી સંસ્થાઓ તરફથી થતાં વૃક્ષારોપજાનાં ઉત્સાહપૂર્ણ અભિયાનોને બદલે કુદરતી વન્યસપનીને રક્ષણ આપવું વધુ યોગ્ય અને જરૂરી છે.

‘ગાંડા બાવળ’ છાપ ઉત્સાહ નુકશાનકારક છે. સાથે સાથે, ધાસિયા મેદાનોમાં મોટાં વૃક્ષો વાવવાં કે, જ્યાં સાગનાં વૃક્ષો ક્યારેય ઉછર્યાન હોય ત્યાં એક સરખાં સાગનાં

## લિફ્ટિંગાવલોડન

વૃક્ષો રોપી દેવા, એટલું જ હાનિકારક છે. રસ્તાની બાજુથે વવાતાં વૃક્ષો માટે, પરંપરાગત રીતે સ્વીકૃત જે દેશી વૃક્ષો ઉછેરતાં, તેનો જ આગ્રહ રખાવો જોઈએ. કઠિયારા અને વનખાતાના કર્મચારી બંને ઉપર પક્ષીનિરીક્ષકોએ પહેલા ક્યારેય ન રાખ્યું હોય તેટલું ધ્યાન રાખવાનું છે. કઠિયારો તો તેની જરૂરિયાત માટે નુકશાન પહોંચાડે છે, પણ સરકારી કર્મચારી વધુ જોખમકારક છે કારણ કે, પહેલાં તો તે એક નિષ્ણાતાની હેસિયતથી પ્રગતશે અને પછી પોતે મનસ્થી રીતે નક્કી કરેલ કાર્ય, અધિકૃત સરકારી ઓકા હેઠળ કરી નાખશે.

મારી આ આકર્ષી ટીકા માટે બબડતાં વનખાતાના અધિકારી ભિન્નો પાસે મારે એ બળાપો કાઢવો છે કે, આજે આપડાને તેમની સૌથી વધુ જરૂર છે તે તેઓ કેમ નથી સમજતાં ? મેં વનખાતાના કેટલાક ઉચ્ચ અધિકારીઓને કહું

છે કે, કોઈ લશકરી ‘જનરલ’ સરહદ ગુમાવશે તો તે પાછી મેળવી શકશો, પણ એક વાર જો આપડો પર્યાવરણ સમતુલ્ય ગુમાવીશું, તો ફરી ક્યારેય તેનું નવસર્જન નહીં થઈ શકે. સદ્ભાગ્યે બાજુ છેક હાથમાંથી નથી જતી રહી. યુવાન અધિકારીઓ તેમના પૂર્વથોડે કરેલું નુકશાન હજી પણ સુધ્યારી શકે તેમ છે. આશા રાખીએ કે, આવતાં વર્ષોમાં ડિગોળગઢમાં બપૈધા અને મોટા કશયાનો અવાજ એટલે નહીં સંભળાય કે તેમનાં રહેઠાણોમાં સુધારો થયો હોય, નહીં કે તેઓ સંદર્ભ નાશ પાખ્યા હોય !

( ઉવે પછી ...પક્ષીનિરીક્ષકશનો આનંદ )

૬૪૬, વાસુનિમાંજિ સોસાયટી, સેક્ટર-૨૨ ગાંધીનગર-૩૮૨૦૨૨



## નિક્રીક્ષણ ટોંડા

### ક્રદ્ધમાં પક્ષીનિરીક્ષકાં

તા. ૧૩-૪-૨૦૦૧ના રોજ ભુજ તાલુકાના ‘એડમન્ લેઇક’ તથા ચાડવા રખાલની મુલાકાત લીધી. મારી સાથે નિયોગ્યન છાપા તથા રમેશ રાઠોડ હતા. ૨૪-૪-૦૧ના રોજ છારી હેઠળ ગયા ત્યારે, અન્ય ભિન્નો સુબોધ હાથી તથા વસ્તંગીરી ગોસ્વામી પણ હતા.

તારીખ	પક્ષીનિરીક્ષકાં	સંખ્યા	સ્થળ
૧૩-૪-૦૧	મધિપો બાજ (Honey Buzzard)	૧૫	ચાડવા રખાલ
		૩	ભારાસર ગામ (વાડી)
		૪	માનકુવા ગામ (વાડી)
૧૩-૪-૦૧	સાંસાગર (Bonelli's Hawk Eagle)	૨.	એડમન્ લેઇક (નહીની ભેખડ પર માળા નજીક)
		૧	ભારાસર ગામ (વાડી)
૧૩-૪-૦૧	શ્યામશીર ગંદમ (Blackheaded Bunting)	૨	એડમન્ લેઇક
૧૩-૪-૦૧	પીળક (Golden Oriole)	૧	ભારાસર (વાડી)
૧૩-૪-૦૧	ગિરજા (Cotton Teal)	૩	ખરી તળાવ
૧૩-૪-૦૧	દૈપડ (Magpie Robin)	૧	ચાડવા રખાલ
૧૩-૪-૦૧	કર્છી પિંદો ( Brown Rock Chat)	૨	એડમન્ લેઇક
૧૩-૪-૦૧	સર્પશીર (Darter)	૩	ચાડવા રખાલ
૧૪-૪-૦૧	ગિરજા (Cotton Teal)	૨	કુકમાનું તળાવ
૧૪-૪-૦૧	ચેતવા (Garganey)	૨	કુકમાનું તળાવ
૧૪-૪-૦૧	ધંટીટાંકણો (Hoopoe)	૧	લેર (વાડી, આ મૃતુમાં જવાલે)
૧૪-૪-૦૧	સાંસાગર (Bonelli's Hawk Eagle)	૩	લેર (વાડી)

### નિરીક્ષણ નોંધ

૨૪-૪-૦૧	મધિયો બાજ (Honey Buzzard)	૪	સુખપર-માનકુવા વચ્ચે
૨૪-૪-૦૧	દેશી ઝુમ્પસ (Tawny Eagle) (સમૃહમાં ઉડતાં, અમુક જાડ પર તથા અમુક જમીન પર બેઠેલાં, ૧ પીલુના જાડ પર આવેલા જૂના માળા નીચે, લખોટીઓ (Pellets) જોવા મળી)	૧૭	છારી હંદ (સૂકો)
૨૪-૪-૦૧	ગિરનારી ગીધ (Longbilled Vulture) ૧ (ઉડતું)	૧	છારી હંદ
૨૪-૪-૦૧	કપારી (Blackwinged Kite)	૧ (ઉડતી)	માનકુવા- સુખપર વચ્ચે (વાડી)

❖ તા ૫-૪-૨૦૦૧ના રોજ કાળા કુંગર ઉપર જવાનું થયું. કાળો કુંગર ઊચાઈમાં, કચ્છમાં પ્રથમ નંબર ધરાવે છે. જો કે, ગરમી ચાલુ થઈ ગઈ હોવાથી એટલાં પક્ષીઓ જોવા ન મળ્યાં. કચ્છી પિંફો (Brown Rock Chat) જોયો. સામાન્ય રીતે આ પક્ષી જમીન પર રહીને ખાતું હોય છે. અમે આ પક્ષીને માખીમાર (Flycatcher)ની જેમ હવામાંથી જીવાં પકડતું જોયું. કવિ તેજે આ બાબતનું ધ્યાન દોર્યું. આ ઉપરાંત રાજ (Yellowthroated Sparrow)ની નોંધ પણ કરી.

❖ તે જ દિવસે (૫-૪-૨૦૦૧) વળતાં દેવીસર તળાવમાં નીચેનાં વિશિષ્ટ પક્ષીઓની નોંધ કરી.

ગયણો (Shoveller) -૧૦, નાની મુરઘલી (Common Teal)-૧, લીલાપગ (Greenshank) -૧, કાળીપુંછ ગડેશા (Blacktailed Godwit) -૨ (ઊણું પોષાકમાં), ટપકીલી તુતવારી (Wood Sandpiper) -૧, વન પીળાંકિયો (Grey Wagtail) -૧, વગેરે.

❖ વીજળીના થાંભલા ઉપર કાળી કંકણસાર (Black Ibis) નો માળો

તા. ૧૪-૪-૦૧ના રોજ રમેશ રાઠોડ સાથે સૈયદપર રખાલ નજીકના ઈલેક્ટ્રીકના ટાવર ઉપર કાળી કંકણસારને માળા પર બેઠેલી જોઈ. તે ઈંડાં સેવતી હોય તેવું લગે છે. ૨૫ થી ૩૦ ફૂટની ઊચાઈ પર માળો હતો. આ અંગેનું સાહિત્ય તપાસતાં આવા માળાની નોંધ થયેલી નથી. અન્ય પક્ષીનિરીક્ષકો પ્રકાશ પાડશે?

❖ તા. ૨૮-૭-૨૦૦૧ના રોજ માણિયા નજીક ધાસિયા પ્રદેશમાં આર.ડી. જાડેજા (આર.એફ.ઓ.) સાથે પક્ષીનિરીક્ષણ કર્યું. સાથે રમેશ રાઠોડ, સુબોધ હાથી તથા ત્રિલોચન છાયા હતા. અહીં નીચે મુજબનાં પક્ષીઓ જોયાં.

૧. ધોરડ (Great Indian Bustard), ૨ નર (એક નર પ્રજનન-નૃત્ય કરતો), ૧ માદા.

૨ ખડમોર (Lesser Florican), ૨ નર, ડેકડા મારતાં.

શ્રી આર.ડી. જાડેજાના કહેવા મુજબ, તેમણે વધારે સંખ્યામાં જોયા છે અને પ્રથમ ખડમોર જૂનમાં જોયો હતો. મેં ખડમોર જિંદગીમાં પ્રથમ વાર જોયાં.

૩. કાળો તેતર (Black Partridge), ૨-૩, સાંભળ્યાં તથા જોયાં.
૪. વર્ષા લાવરી (Rain Quail), ૬-૭ જોઈ તથા સાંભળ્યી.
૫. વૈયાં (Rosy Pastor), ૧૦ થી ૧૫નું ટોળું, અસ્તુમાં પ્રથમ.
૬. આગિયો ચંદૂલ (Redwinged Bushlark) ૨-૩
૭. અગન ચંદૂલ (Singing Bushlark), ૨-૩.
૮. નાની પાનટીકટીકી (Streaked Fantail Warbler), ૮-૧૦.

### શાંતિલાલ વર્ક્સ

જૂના વાસ, મેટિરવાળો ખાંચો, માયાપર, જુઝ-૩૭૦૦૦૧

+ + +

### કચ્છમાં સફેદ સુરખાબ (Common Shel duck)

► ૩૧-૧૨-૨૦૦૦ના રોજ જ્યારો, દરિયાદિનારે મીઠાની ક્યારીમાં, દ સફેદ સુરખાબ જોવા મળી. આ અતિ વિરલ પક્ષી જોવાનો ખૂબ જ આનંદ આવ્યો. આ ઉપરાંત વિશિષ્ટ અવલોકનમાં ઉશ્યાળું નાની ઝૂબકી (Blacknecked Grebe) પણ જોઈ. તા. ૭-૨-૨૦૦૦ના રોજ જુઝથી ૧૨ ક્રિ.મી. દૂર આવેલા ઢોસા તળાવની શ્રી નવીન બાપટ તથા શ્રી મતાપ સેવક સાથે મુલાકાત લેતાં, અન્ય પાણીનાં પક્ષીઓ તથા યાયાવર બતકો સાથે ઉ નિલાશિર (Mallard, ૨ નર, ૧ માદા) જોઈ.

### અશ્વન પોમલ

પોમલ જીલેક્સ, વેકળા ચોક, જુઝ-૩૭૦૦૦૧

► કચ્છમાં સફેદ સુરખાબ, પહેલી વાર, તે સમયના બ્રિટીશ પોલિલિટિકલ એજન્ટ કર્નલ સી.બી.ઓબ્રાયને ૧૮૨૧માં બચાઉ પાસે જોઈ હતી અને એક નમૂનો મેળવ્યો

## નિરીક્ષણ નોંધ

હતો. ત્યાર બાદ, લગભગ ૪૫ વર્ષ સુધી એ યાયાવર પક્ષી કચ્છમાં નોંધાયું ન હતું. એ પછી સન ૧૮૮૬ની ૪થી ડિસેમ્બરે મહારાઓ મદનસિંહજીએ વિજયવિલાસની પશ્ચિમમાં બેસફેદ સુરખાબ બતક નોંધી હતી. ૧૮૮૭માં શાંતિલાલ વર, નવીન બાપ્ત વગેરેએ એક બતક રૂક્માતા ડેમમાં જોઈ.

હાલ ૧૩ વર્ષ બાદ, ૧૭મી ડિસેમ્બર ૨૦૦૦ના રોજ જ્ઞાની પાસેના મીઠાના અગરમાં, અચિન પોમલ તથા કવિ તેજે આ બતક દ્વારા સંઘામાં જોઈ. ત્રણેક દિવસ બાદ નણીયા ખાતેના આર.એફ.ઓ. શ્રી આર.ડી. જીંગાંગ, કવિ તેજ તથા નવીન બાપ્ત ફરી મીઠાના અગરની મુલાકાત લીધી ત્યારે, ૧૦ની સંઘામાં આ બતક હતી. આમ કચ્છમાં પહેલી વાર આ બતકની મોટામાં મોટી સંઘા જોવા મળી.

કરાંચી(પાડિસ્તાન) પાસે નાળો અને કાદવિયા ભાગોમાં તે કોઈ વાર સારી સંઘામાં જોવા મળે છે. આ યાયાવર બતક પાડિસ્તાનમાં પણ નિયમિત શિયાળુ મુલાકાતી નથી તેમાં છતાં, ૧૯૭૦ના દાયકામાં કરાંચી બંદર વિસ્તારમાં તે મોટામાં મોટી ૨૮ઊની સંઘામાં નોંધાઈ હતી.

**મ. કૃ. શ્રી ઈમનાંદિલજી**

(કચ્છમિત્ર) તા. ૨૩-૧-૨૦૧૧ના સૌઝન્યથી)

» મારી કચ્છમાં સફેદ સુરખાબની નોંધ

તારીખ	સ્થળ	સંઘા
૧૫-૧૧-૮૭	રૂક્માતા ડેમ (તા. ભુજ)	૧ (માદા)
૭-૧-૨૦૦૧	મીઠાના અગર, જ્ઞાની (તા. અબદાસા)	૫

શાંતિલાલ વર

જૂન વાસ, માંદિરચાણે ખાંચે, માધ્યપર, ભુજ ૩૮૦૦૨૦

» મે, શ્રી લાલસિંહભાઈ તથા શ્રી. પી. એસ. કફ્ફર સાથે તા. ૨૦-૧-૮૮ના રોજ જગમાલ બેટ ઉપર (કચ્છના મોટા રજામાં, સૂરી ગામની પશ્ચિમે તથા નડાબેટની ઉત્તરે) એ સફેદ સુરખાબ જોઈ હતી.

**ડૉ. બંકુલ નિવેદી**

૧૮/૪૧૪, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫

+++

» રાજ્ય ધોરી માર્ગ પર સર્કિય માણા-વસાહત

હું મારા મિત્ર સાથે તા. ૪થી જુલાઈના રોજ કલોલ જતો હતો ત્યારે, રસ્તામાં શેરથા ગામ-તળાવના કંઠે બાવળનાં

બે જાડ પર સફેદ કંકણસાર(White Ibis) તથા ઢોર બગલા (Cattle Egret)ના માળા જોયા. અમે રસ્તામાં રોકાયા તથા મે જરૂરી માહિતી મારી નોંધપોથીમાં ટપકાવી લીધી.

અમદાવાદ- મહેસૂસાણા ધોરી માર્ગ પર વાહનોની ખૂબ જ અવરજની રહે છે, આમ છતાં આ બંને વૃક્ષો પર પક્ષીઓ આરામથી બેઠાં હતાં. બધા માળામાં પક્ષીઓની હાજરી હતી. એક જાડ પર ૨૭ માળા હતા. જેમાંથી ૧૮ માળા સફેદ કંકણસારના હતા, જ્યારે ૮ માળા ઢોર બગલાના હતા. બીજા બાવળ પર કુલ દસ માળા હતા, જેમાં આઠ માળા ઢોર બગલાના હતા. દરેક માળામાં એક પક્ષી બેઠેલું હતું. દરેક માળાની બાજુમાં બીજું એક પક્ષી હતું.

રવીછક્કર

૨૪, ન્યુ નાન્દનવન સોસાયટી, 'ઇસરો' પાછળ, અમદાવાદ ૩૮૦૦૧૫

+++

**અમદાવાદમાં પચરંગી શક્કરખોરાની**

(Purplerumped Sunbird) હાજરી, હવે

નિયમિત ઘટના

તા. ૧-૭-૨૦૦૧ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે હું જ્યારે ઘરના પાછળના ભાગમાં ઓટલા ઉપર ઊભો હતો ત્યારે, કાંટાવાળા તારની વાડના એક તાર પર મે નર પચરંગી શક્કરખોરો જોયો. લગભગ એકાદ કલાક તેને આસપાસમાં વૃક્ષોમાં ઊડતો જોયો. ઘરનાં સૌએ ઘરાઈને જોયો. એ હિંસે માદાને ફક્ત એક વાર ઊડતી જોઈ, પરંતુ બીજા દિવસે સવારે નર-માદા બંનેને કરંજના જાડ પર ચેડેલી મધુમાલતીના ફૂલના ગુચ્છા પર નિરાંતે જોયાં. તા. ૭ જુલાઈના રોજ પણ બંને પક્ષીઓ જોયાં.

આ પક્ષીની નોંધ આ પહેલાં શ્રી લવકુમાર ખાચર દ્વારા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, થલતેજ ટેકરા આગળ, સુંદરવન ખાતે શ્રી ઊર્ફ દ્વારા, ડૉ. બંકુલ નિવેદી દ્વારા સેટેલાઈટ રોડ પરના તેમના રહેઠાણ પાસે તથા ડૉ. બલર દ્વારા શ્રેયસ ટેકરા આગળના તેમના રહેઠાણ પાસે થયેલી છે. આમ પચરંગી શક્કરખોરાની અમદાવાદમાં હાજરી એ અક્સમાત નરી પણ નિયમિત ઘટના છે, તેમ કંઈ શકાય.

**અમદાવાદમાં પીળી ચોટીલી રામચકલી**

(Yellowcheeked Tit)

૩૧-૩-૨૦૦૧ના રોજ અમદાવાદમાં, હું જે

## નિર્વિકલ્પા નોંધ

ઓફિસમાં કામ કરું છું તાં, ‘અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર’માં પીળી ચોटીલી રામયકલી જોવા મળી. ઓફિસ જતાં રસ્તામાં અચાનક મારી નજર એક સોનેરી પક્ષી પર પડી, જે હું પહેલી વાર જ જોતો હતો. આ પક્ષી રસ્તામાં નાળા પાસે આવેલા દસ-બાર લીમડા તથા ગુંડાનાં વૃશોના ઝુંડમાં ઊદ્યા કરતું હતું. તે નીચેથી ઉપર તરફ જતાં ગોળ ઢા જેવું બની જતું હતું. વળી, પૈણા ફૂલવાળા સપ્તરંગી (Lantana camera)ના છોડ વચ્ચે શોભામાં અભિવૃદ્ધિ કરતું જમીન પર બેઠેલું આ સોનેરી પક્ષી દીપી ઊદ્યા હતું. શરીર પર રહેલો કણો રંગ તેની સુંદરતામાં ઔર વધારો કરતો હતો. આમ અહીં તઈં નીચેથી ઉપર તરફ ઢાના રૂપમાં ઊડતા આ પક્ષીને લગભગ દસ-બાર મિનિટ જેટલો સમય નિહાળી, તેને ઓળખીને હું મારા મૂળ કામે રૂમ પર પહોંચી ગયો. પાછા ફરતાં ફરી પાછો તે સ્થળ પર પહોંચી, તે પક્ષીને શોખવાનો પ્રયત્ન કર્યો પણ તે જોવા મણ્યું નહીં અને ત્યાર બાદ, આજ સુધી નજરે ચક્કણું નથી.

સાહિત્ય જોતાં જ્ઞાયું કે, સામાન્ય રીતે આ પક્ષી જંગલ વિસ્તારમાં ઘટાદાર વૃશોની ટોચ પર જોવા મળે છે. આટલી નીચી. ઊચાઈએ તથા નીચેથી ઉપર તરફ ઢાના રૂપમાં ઊડતું તે શું તેનું સંવનન નૃત્ય હશે !?

આ પહેલાં કોઈ મિન્ટે વડોદરામાં આ પક્ષી જોયું હતું, તેવું શ્રી-લાલસિંહભાઈ રાઓને જ્ઞાયું હતું.

### **ગુજરાતમાં કર્શના મોટા રણમાં દરિયાઈ ગરૂડ**

ભારતમાં દરિયાઈ ગરૂડ (Whitebellied Sea Eagle) પદ્ધતિના દરિયા ડિનારે મુખાઈની દક્ષિણો અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં તથા દક્ષિણ ભારતના પૂર્વ ડિનારે શ્રીલંકાથી શરૂ કરી, ઉત્તરે બાંગલાદેશ, બર્મા (ભ્યાનમાર) તથા મલયેશિયાથી ઓસ્ટ્રેલિયા સુધી જોવા મળે છે, તેવું શ્રી સલીમ અલીને પોતાના પુસ્તક 'The Book Of Indian Birds' માં જ્ઞાયું છે.

સલીમ અલી, ૧૯૪૪-૪૫માં જ્યારે પક્ષીઓના સર્વેક્ષણ માટે ગુજરાતમાં આવ્યા ત્યારે, તેમને એક પણ દરિયાઈ ગરૂડ જોવા મણ્યું ન હતું. તેમના આ સર્વેક્ષણ પહેલાં હ્યુમ કે બટલર જેવા પક્ષી-નિષ્ણાતોએ પણ ગુજરાતમાં આ પક્ષીની હાજરીની નોંધ લીધી નથી. તે સમયે ગુજરાતમાં નાનાં મોટાં રજવાડાં અસ્તિત્વ ધરાવતાં હતાં. રાજાઓ તથા

નવાખો જેઓ પક્ષીઓનો શિકાર કરતાં હતાં, તેમાંથી પણ કોઈએ દરિયાઈ ગરૂડ ગુજરાતમાં જોવા મળે છે, તેવી કોઈ નોંધ છોડી નથી.

ભાવનગરના મ. કુ. શ્રી ધર્મકુમારસિંહજાયે તેમના પુસ્તકમાં આવું એક પક્ષી તળાજી પાસે, શેન્નુંજના મુખ-પ્રદેશમાં જોયું હોવાનું નોંધ્યું છે. આ ઉપરાંત અમદાવાદના શ્રી હરિનારાયણ આચાર્ય, હમી ફેલ્લુઆરી ૧૯૭૮ના રોજ એક પક્ષી ગોબલજના તળાવમાં જોયું હતું. ગોબલજ અમદાવાદ-વડોદરાના રસ્તે અમદાવાદથી ૨૮ ક્ર.મી. જેટલા અંતરે આવેલું છે. દરિયાકાંઠો અહીંથી લગભગ ૮૦ ક્ર.મી. જેટલાં અંતરે છે.

શ્રી લવકુમાર ખાચર (૧૯૭૩) આ પક્ષીને ગુજરાત માટે વિરલતમ ગણાવે છે. શ્રી લાલસિંહભાઈ રાઓલે પોતાની 'પ્રકૂતિ પરિચય શ્રેષ્ઠી'નાં ચાર પુસ્તકોમાં આ પક્ષીનો સમાવેશ કર્યો નથી. શ્રી સલીમઅલી તથા રીપ્લેના પુસ્તક 'The Hand book of Birds of India and Pakistan' ના પ્રથમ ભાગમાં ઉપરની બંને નોંધનો ઉલ્લેખ કરેલ છે. આમ ગુજરાતમાં આ પક્ષીની હાજરીની નોંધ માત્ર બે વાર થઈ હોય તેમ લાગે છે.

૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧માં ગુજરાતમાં આવેલ ભયંકર ભૂકુંપના પરિણામે કર્શના મોટા રણમાં મીહું પાડી નીકળ્યું હતું. તેની ખાતી કરવા માટે કર્શના મોટા રણના વિવિધ વિસ્તારોમાં ત્રણ વખત જવાનું થયું હતું. પહેલાં ૧૨ ફેલ્લુઆરી, ૨૦૦૧, ત્યાર બાદ, ૧૨ મે, ૨૦૦૧ તથા ગીજ વખત ૫ જૂન, ૨૦૦૧ના રોજ હું તાં જાપો હતો. તા. પમી જૂન, ૨૦૦૧ના રોજ હું પરચમ બેટની ઉત્તરે જ્યાંથી પાડી નીકળતું હતું તાં, પાડી તથા ત્યાંથી નીકળતા વાયુના નમૂના એકત્ર કરવા ગયો હતો. અમે છાપ્યે બેટથી આગળ નીકળી નરવેરી 'બી.એસ.એફ. પોસ્ટ' તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે એક પીલુના વૃક્ષ પર કાળું અને સર્કણ, મોહું ગરૂડ જોયું. ગાડી થોંબાવી પહેલાં નિરીક્ષણ કર્યા બાદ ફોટો પાડવા નીચે ઉત્તર્યો. પક્ષી ત્યાંથી ઉડી થોડે દૂર જઈ બેહું. વાતાવરણ વાદળ છાયું હતું, રણમાં ભીનાશ હતી અને જો વરસાદ પડે તો ગાડી ત્યાં રણમાં જ છોડીને પાછા નીકળતું પડે તેવા સંભેગોમાં તથા જે કામે નીકળ્યા હતા તે કામ પહેલાં પતાવવું તેમ નક્કી કરી અમે આગળ વધ્યા. 'નરવેરી પોસ્ટ' પર પહોંચાયા પછી 'The Book of Indian Birds' જોઈ તો ખ્યાલ આવ્યો.

## નિર્વિકલ્પા નોંધ

કે મે જે પક્ષી જોયું હતું તે દરિયાઈ ગરૂડ હતું. મારા આજ સુધી જોયેલ પક્ષીઓની યાદીમાં આમ એક પક્ષીનો ઉમેરો થયો અને ગુજરાતમાં માત્ર બે જ 'રેકોર્ડ' હતા તેમાં પણ એકનો વધારો થયો.

ગોલભજ, તળાજી તથા કચ્છના મોટા રણમાં આ પક્ષીની હાજરી દશાવિ છે કે ગુજરાતના ૧૬૦૦ ક્રિ. મી. જેટલા લાંબા દરિયાકંઠા પર આ પક્ષી જરૂર રહેતું જ હશે, પરંતુ આપડા મયરીદિત પક્ષીનિરીક્ષકો તથા તેમની દરિયાકંઠાની કે કચ્છના રણની મયરીદિત મુલાકાતોને લાયે આ પક્ષીની ગુજરાતમાં હાજરીની નોંધ ઓછી લેવાઈ હશે. કચ્છના મોટા રણમાં એપ્રિલ-મે મહિનામાં નૈત્રક્તયના મોસમી પવનોના કરારો તથા મોટી ભરતીના કારણે સમુદ્રનાં પાણી છેક 'ઈન્ડિયા બ્રીજ' તથા 'પંજાબી બ્રીજ' સુધી આવી જાય છે. આ વર્ષે આ પાણી 'પંજાબી બ્રીજ' ઓળંગીને છઘર બેટથી પણ આગળી આવી ગયું હતું. આથી આ પક્ષી સમુદ્રના પાણી સાથે સાથે આ વિસ્તારમાં આવ્યું હશે તેવી શક્યતા છે.

ફી. એસ. ટક્કર

૨૪, નુંનંનવન સોલાયારી, 'દીક્ષિયો' પાછળા, અમદાવાદ ૩૮૦૦૧૫

\*\*\*

### ■ 'કલોઝ સરકીટ કેમેરા' દ્વારા દૈયડના પ્રજનનની નોંધ

'નેચર કલબ', સુરત દ્વારા પક્ષીઓ માટે લાકડાના કૃત્રિમ માળાઓ બનાવીને ડેર ડેર મૂકવામાં આવ્યા છે. 'નેચર કલબ', સુરતના મકાનની બહાર રાખેલા આવા એક માળામાં આ વર્ષે દૈયડે પ્રજનન શરૂ કર્યું. .

'નેચર કલબ', સુરત દ્વારા આ દૈયડના માળામાં 'કલોઝ સરકીટ કેમેરા' મૂકવામાં આવ્યો હતો અને તેના ઉપર સતત દેખરેખ રાખવામાં આવતી હતી. આ પરથી વિડિયો કેસેટ પણ તૈયાર કરવામાં આવી છે.

દૈયડે જે પાંચ ઈંડાં મૂક્યાં હતાં, તેમાંથી બે ઈંડાં રણમી મેના રોજ, બીજાં બે ઈંડાં રણમી મેના રોજ તથા એક ઈંડું રણમી મેના રોજ મૂકવામાં આવ્યું હતું. દૈયડે માળાની કિનારી પર સૂકું ધાસ મૂક્યું હતું અને અંદરના ઉપરના ભાગે નરમ ધાસ હતું.

ઈંડાનો રંગ આછો કથ્થઈ હતો અને તેની ઉપર કથ્થઈ રંગનાં ટપકાં હતાં. ઈંડાનો આકાર એક બાજુથી મોટો અને બીજી બાજુ સાંકડો હતો. ઈંડાની કુલેલી બાજુએ ટપકાં

મોટાં અને નજીક નજીક હતાં. મોટે ભાગે ઈંડા સેવવા માટે માદા બેસતી હતી. તે દરમિયાન કોઈક વાર માદા માળાની બહાર જતી હતી.

પ મી જૂને પ્રથમ બે ઈંડાંમાંથી બચ્યાં બહાર આવ્યાં હતાં. દ જૂને બીજાં બે ઈંડાંમાંથી અને ત જૂને એક ઈંડાંમાંથી બચ્યું બહાર આવ્યું હતું. ઈંડા સેવવાનો સમય ૧૪ દિવસનો હતો. જ્યાં સુધી બચ્યાં બચ્યાં ઈંડાંમાંથી બહાર ન આવ્યાં. ત્યાં સુધી માદા ઈંડાં પર બેસતી હતી. નર, બચ્યાં માટે ખોરાક લાવવાનું કામ કરતો હતો. માળાની સફાઈનું કામ માદાનું હતું.

દૈયડનાં ઈંડાં બે ભાગમાં તુટેલાં હતાં. બીજાં પક્ષીઓ કે પ્રાણીઓને ખબર ન પડે તે માટે દૈયડ ઈંડાનાં કાચલાંને માળાથી દૂર નાખી આવતી હતી. દૈયડ બચ્યાંની નીચે ચાંચ નાખી તાપમાન તપાસતી હતી અને માદા, તાપમાન જીળવી રાખવા માટે બચ્યાંને ખેસેડી હતી. બચ્યાં જન્મ્યાં ત્યારે કથ્થઈ રંગનાં હતાં. સમય જતાં તેનો રંગ વેરો કથ્થઈ હતો ગયો.

બચ્યાનાં જન્મ વખતે તેની અંખ બંધ હતી. પાંચ દિવસ બાદ આંખ ખુલી ગઈ અને થોડાં થોડાં પીંઠાં આવી ગયાં. સાત દિવસ બાદ સફેદ પણી ઉપરનાં સફેદ પીઠાં દેખાતાં થયાં. દૈયડ, બચ્યાંને ખાવા માટે કીડી, ઈયણ, ગોળગાય, પતંગિયાં અને ભયરાં જેવાં નામાં નામાં જીવડાંઓ આપતું હતું.

બચ્યાં ઈંડાની બહાર આવ્યા બાદ, ૧૪ દિવસ પછી ઊડી ગયાં. ૨૧મી જૂનના રોજ બે બચ્યાં, ૨૨મી જૂનના રોજ બે બચ્યાં તથા ૨૩મી જૂનના રોજ એક બચ્યું એમ બધાં બચ્યાં ઊડી ગયાં. બચ્યાં માળામાંથી ઊડી ગયા બંદ ૩-૪ દિવસ સુધી બહાર દૈયડ તેમની કાળજી રાખતું હતું. દૈયડનો માણો ખાલી પડી ગયો.

દરજાએ નજીકમાં માળો બનાવ્યો છે. 'કલોઝ સરકીટ કેમેરા' દૈયડના માળામાંથી ઉઠાવી દરજા (Tailor Bird) ના માળામાં મૂકવામાં આવ્યો છે અને તેનું 'રેકોર્ડિંગ' કરવામાં આવી રહ્યું છે.

'કલોઝ સરકીટ કેમેરા'ની માત્ર ૪ સે.મી. (૨ ઈંચ) ગોળાઈ અને લંબાઈ છે. તે વધું ઓછું વજન ધરાવે (૩૦૦ ગ્રામ) છે અને જરૂર હોય ત્યાં સરળતાથી ટેપની મદદથી લગાડી શકાય તેવો છે. કલોઝ સરકીટ કેમેરા બે પ્રકારના હોય છે. એક ટેલિવિઝન પર ફક્ત ચિન્ત બતાવે છે

અને બીજો અવાજ સાથે ચિત્ર બતાવે છે. ટેલિવિઝન પર ફક્ત ચિત્ર બતાવતા કેમેરાની ડિમ્યત રૂ. ૩૫૦૦ અને અવાજ સાથે ચિત્ર દર્શાવતા કેમેરાની ડિમ્યત રૂ. ૪૦૦૦ છે. તે મુખ્યમાં પ્રાપ્ત છે. આ કેમેરા માટે ૬ V.D.C. પ્રવાહની જરૂરિયાત હોય છે અને કેમેરામાંથી એક વાયર ટેલિવિઝન સાથે જોડવો પડે છે. અમે ચિત્રના પ્રસારણને ઓછામાં ઓછી અસર થાય એ માટે કેમેરાથી ટેલિવિઝન સાથે જોડેલ 'વાયર'ની લંબાઈ ૫૦ ફુટથી ઓછી થાય તેવો પ્રયત્ન કરીએ છીએ. ઓછા પ્રકાશમાં પણ ચિત્રનું પ્રસારણ ઘણું સરસ થાય છે.

'વિડિયો પ્લેયર'ની મદદથી આ પ્રસારણનું 'રેકોર્ડિંગ' પણ શક્ય બન્યું છે અને 'ડીજિટલ વિડિયો કેમેરા'ની મદદથી તસવીર પણ બનાવી શકાય છે.

### નિર્મણબેન ચાથોથ

કૃત

+++

### કલકલિયાની તીક્ષ્ણ દસ્તિ અને અચૂક નિશ્ચાન

વરસો પહેલાંની વાત છે. તે વખતે અમે પોરબંદરમાં અમારા જૂના ઘરે રહેણે હતાં. સૂર્ય ઉગ્ગા ગયો હતો. મારી ડાબી બાજુ બારીની શાખ પાસે ત્રણ - ચાર ઈંચ દૂર, ભીત પર, ગરોળી બારીની છાજલીના છાયામાં આરામ કરી રહી હતી. અમારાથી ૪૦૦-૫૦૦ ફુટ દૂર એક મેમાણની ત્રીજા માળની બંગલી પર એક કલકલિયો બેઠો હતો. એટલે દૂરથી તેણે ગરોળીને જોઈ લીધી હતો. ત્યાંથી ઝડપથી ઉડી આવીને અચાનક ગરોળીને ચંચામાં પકડીને પોતે પહેલાં જ્યાં બેઠો હતો તે તરફ ઉડી ગયો. આ બધું ક્ષાશાર્થમાં મારી સાવ નજીક બની જતાં હું તો ડઘાઈ જ ગયો. કલકલિયાની તીક્ષ્ણ નજીરે એટલે દૂરથી ગરોળી જોઈ લીધી અને પલકવારમાં તેને ઉધાવીને ઉડી ગયો.

### નિષ્ફળ પ્રયત્ન

અમારા નવા ઘરના 'રેલવે લાઈન' તરફના ઓરડાની બારીના 'વેન્ટીલેટર' પર હોલું બેઠું. અચાનક એક શિકારી પક્ષી તેના પર ત્રાકયું, પણ હોલું જ્યારું ન આવતાં છટકને ઉડી ગયું. શિકારી પક્ષી 'વેન્ટીલેટર' પર એટલા જોરથી અથડાયું કે તેને કણ ચડી ગઈ અને તરફડવા લાગ્યું. હાથે નેપકીન વાટી, 'વેન્ટીલેટર' જરા ખોલી, તે પંખીને પકડીને મે ધરમાં લીધું. પિતળના ખાલી પાંજરામાં પડી રહ્યું. થોડા કલાક બાદ પાંજરું અગાશીમાં મૂકી, તેનું બારણું ખુલ્યું કરી, હું દૂર જતો

રહ્યો. આટલા વખતમાં કણ ઉત્તરી ગઈ હશે તેથી તરત તે શિકારી પંખી પાંજરાના ખુલ્લા બારણામાંથી ઉડી ગયું.

### તને ન ગમે તો નહીં !

પોરબંદર પાસેના કુછદી ગામની પૂર્વમાં રશની ઉગમણી કંધી પર ચામુંડાનું મંદિર છે. તેની બાજુમાં નાના અવેડાવાળી વાવ છે. તેના પર પાવટો હતો. તેને ચલાવીને એક મેર ભગત રોજ અવેડો ભરતો. આ પાવટાની લાકડાની ધરી પર બેસી એક કલકલિયો નીચે વાવના છાંયડામાં પાણીમાંના દેડક જોતો હતો. મોકો મળતાં ઉપરથી પદે તેમ પાણીમાં પડી દેડકું પકડી પાણીની સપાટી પર આવી ઉડી જતો. રોજ આમ દેડકાનો શિકાર થાય તે પેલા ભગતને ગમતું નહીં.

એક ટિવસ ભગતે ચણા જેવડી ઘણી બધી કંકરીઓ બેગી કરીને પોતાની પછેડીની ખોયમાં ભરી. પછી પોતે છુપાઈને કલકલિયાની રાહ જોવા લાગ્યો. જેવો કલકલિયો આવ્યો કે તેણે પાવટાની ધરી પર બેઠેલા તેની પર જોરથી પછેડીમાંથી કંકરીઓ એક સાથે ફેકી. તેમાંની એક કલકલિયાને વાગી અને તે વાવમાં પડ્યો. પાણીમાં તરફડિયા ખાતા એ કલકલિયાને મેર ભગતે પકડીને બહાર કાઢ્યો. પોતાની લાકડીના એક છેડે તેને દોરીથી બાંધી સાંજે ગામમાં આવ્યો. મારા પિતાશીએ તે પંખીને છોડી મૂકવા ભગતને કહ્યું. તેણે કલકલિયાને છૂટો કર્યો કે તરત તે ઉડી ગયો, પણ ફરી પેલી વાવ પર દેખાયો નહીં !

### સ્વાહા !

ધૂંકિયાએ (Coccajal) કાચિંડો પકડ્યો, અને મારા 'કંપાઉન્ડ' ની હિવાલ પર બેઠો. કાચિંડાનું મોહું પોતાની ચાંચામાં લીધું અને ડોકના આંચકાથી કાચિંડાને ગળવા લાગ્યો. આગલા બે પગ અંદર ગયા પછી તેની ડોકનું હલનચલન બંધ થયું. મને થયું, તે કાચિંડાને બહાર કાઢી ટુકડે ટુકડે ખાઈ જશે, પણ ના, અંદરથી જાણે કોઈ ખેચતું હોય તેમ તેની હોજરીએ કાચિંડાને અંદર ખેચી લીધો. દોઢેક ઈંચ પૂછી બહાર હતી અને તે ઉડી ગયો.

સ્વ. મણિલાલ વોરા

પોરબંદર

(ઉપરની ચાર નોંધ, શ્રી લાલારિંગ રાન્ડોલ ૫૨૩-૨-૮૪૩૪ પચમાંની લાપદ્ધ છે.)

+++

## ગીર અને ચરકલાની મુલાકાત


સાવરકુંડલાથી શ્રી ભાનુભાઈ અધ્વર્યુ અને શ્રી કાસમભાઈના સહકાર, માર્ગદર્શન અને આમંત્રણથી હોશે હોશે તા. ૨૨, ૨૩ જૂનના દિવસે ગીરની મુલાકાત ગોઠવી. ગીર, આ વર્ષના અનુદૂણ વરસાદથી સોળે કણાએ ખીલ્યું હતું. ગીરની સરહદે આવેલું ‘હનુમાનગાળા’ પક્ષીનિરીક્ષણ માટે ઉત્તમ સ્થળ છે. ત્યાંથી ખૂબ નજીક જરણાને કાંઠે, ગીય ઝડીમાં નવરંગ (Indian Pitta) જોવા મળ્યો. નજીકમાં જ તેનો માળો પણ હતો. હનુમાનગાળાના મંદિરની પાછળના વડ ઉપર પીળકનો માળો હતો. તે ઉપરાંત એ જ વડ ઉપર પંચિસથી વધુ હરિયલ (Green Pigeon) જોયાં.

તુલસીશયામ પાસેના બાપુના આશ્રમમાં રાત્રિ રોકાણ પણ આઢુલાદક રહ્યું. અહીં બાજુની નદી ઉપરના ડેમની પાળીએ રાત્રે દશરથિયું (Indian Nightjar) સાંભળવા અને ગાડીના પ્રકાશમાં જોવા મળ્યું. આ ઉપરાંત ગીરની અંદરના લાંબા પ્રવાસમાં કાબરો રાજીવાલ (Whitebellied Minivet) સારી રીતે જોવા મળ્યો.

તા. ૧૩થી ૧૫ જુલાઈ, ૨૦૦૧ દરમિયાન ચરકલાની મુલાકાત લીધી.

રસ્તામાં કાલાવાડ પહોંચતાં પહેલાં એક નાની ટેકરી ઉપર આવેલી હોટલમાં ચા પીવા રોકાયા. ત્યાં પડેલા જુવારના કણસલા ઉપર નાના ચંદૂલ (Syke's Crested Lark) ની જોડીને પેટપૂજ કરતા જોઈ.

૧૪મીની સવારે, ૮ વાગતાં પહેલાં ચરકલા આવ્યા. અલગ અલગ જગ્યાઓ થઈને ૪૦૦૦થી વધુ મોટા હંજ (Greater Flamingo) અને ૧૦૦૦થી વધુ નાનાં હંજ (Lesser Flamingo) જોયા. ચરકલાની જગ્યા માટે આટલી સંખ્યામાં હંજની દાજરી સ્વાભાવિક છે. આશ્રમ વચ્ચે, એકી સાથે એક નાનકડા ટાપુ ઉપર, ૪૦૦ કે તેથી વધુ, વચ્ચે



કાજિયા (Indian Shag) તેના પ્રજનન પોશાકમાં જોવાનો હાવો મળ્યો. અગરની વચ્ચેથી પસાર થતા રસ્તાની બાજુના ટાપુ ઉપર સૌથી નજીક એક જ છન્દીમાં એક સાથે ૪૨ વચ્ચેટ કાજિયાને કેદ કરી શક્યો. ઉપર જણાવેલા ટાપુ ઉપર વચ્ચેટ કાજિયાની સાથે તેનાથી વધુ સંખ્યામાં મોટી વાબગલી (Caspian Tern) પણ હતી.

અન્ય કાદવ પૂંદનારા (Waders)માં છૂટા-છવાયા, વિશાળ સંખ્યામાં, પ્રજનન અને શિપાળુ પોશાકમાં થેત્પીડ કીચડીયા (Curlew Sandpiper) અને અલ્ય સંખ્યામાં કાળો રાતાપગ (Spotted Redshank) ખાસ ધ્યાન ખેંચતાં હતાં.

અગરની વચ્ચેની પાળી ઉપર મીઠાના ફેરા માટે ખટારો ચાલી શકે તેવા કાચા કપગીના રસ્તા છે. એવા એક રસ્તા ઉપર બે ચીલા વચ્ચેના ગાળા ઉપર ગજપાંઊ



(Blackwinged Stilt)ના બે માળા અને ટિટોરી (Redwattled Lapwing) નો એક માળો જોયો. ત્રણે માળામાં ઈંડાં હતાં અને સેવન થતું હતું. ખટારો આવે ત્યારે પક્ષી માળા ઉપરથી ઉડી જતું અને ખટારો જતો રહેતાં પરત આવી માળા પર બેસી જતું હતું. આવા અવર-જવરવાળા રસ્તા ઉપર માળા બાંધવા માટે ઉપરોક્ત બન્ને પક્ષી તેમ પ્રેરાણાં હશે? મીહું લઈ જવા માટેના ખટારાના ફેરા ચોક્કસ સમયે શરૂ થાય છે. મને લાગે છે કે, જ્યારે માળા બનાવ્યા હશે ત્યારે, આ ફેરા શરૂ થયા નહીં હોય. બીજા એક અવાવરુ રસ્તા ઉપર ભૂલામણી ઢોગીલી (Kentish Plover)નો માળો જોવા મળ્યો. તેનાં ઈંડાં કદમાં નાનાં તથા અન્ય બાટણ (Plover)નાં ઈંડાંને મળતાં આવતાં હતાં.

ભૂલામણી ઢોગીલીની માદા અમને માળાની જગ્યાથી દૂર રાખવા અને છેતરવા માટે, માળાથી થોડે દૂર

## નિર્દેશાલા નોંધ

ભોપસરસી લપાતી લપાતી પાંખો પ્રસારીને જે રીતે ગોળ ગોળ ફરતી હતી તે જોવાની ખૂબ મજા પડી.

તા. ૧૬ જુલાઈના રોજ મુલાકાતનો છેલ્લો દિવસ હોઈ સવારના આઠ વાગતાં ફરી ચરકલા હાજર થઈ ગયા. ઉપરોક્ત અવલોકનમાં વધારો ન થયો પણ પંથી કયારામાં ઠલવાતા પાણીમાં આવી ચહીની માછલીને પકડવા માટે ઉપર હવામાં ચક્કર મારતી અને પાણીમાં રૂબકી મારી માછલી પકડતી પચાસેક મોટી વાબગલી (Caspian Tern) જોવાની ખૂબ મજા પડી.

ડૉ. આર. બી. બલર

૧૦, સ્ટીટ હોમ સોસાયરી, શ્રેષ્ઠ ટેકરા પાસે, અમદાવાદ ૩૮૦૦૧૫

\*\*\*

### ખૂંપની ઈંડાં ઉપર અસર

દેશી મરધાં, બતક, હંસ તેમજ ટર્કી જેવાં પક્ષીઓ પાળવાનો અમારો વર્ષો જુનો શોખ છે. વર્ષમાં સામાન્ય રીતે અમે બે વાર ઈંડાં સેવડાવી બચ્ચાં તૈયાર કરતાં હોઈએ છીએ. હેમેશાં જુદા પીજારામાં, લાકડાના ખોખાની અંદર સુંકું ઘસ મૂકી, ઈંડાં સેવડાવવાની તૈયારી કરીએ છીએ. જે ઈંડાં સેવડાવવા હોય તે તપાસી લઈએ છીએ. જે ઈંડાં જીવવાળા (નરમાદાની સંતતિ થઈ છોય તેવાં) હોય તેને જ પસંદ કરીએ છીએ, જેથી ઈંડાં બગડે નહીં. માદાને પંદરથી વધુ ઈંડાં સેવવા આપવામાં આવતાં નથી. વધુ ઈંડાં હોય તો માદાનાં પીંછાના વેરાવામાંથી બદાર રહે અને બગડી જાય. તારીખ ૨૫ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ઈંડાં ઉપર મરધી બેસાડવામાં આવી હતી. ૨૫મી જાન્યુઆરીના રોજ ખૂંપનો ભયંકર આંયકો આયો, એ દરમિયાન મરધીએ પોતાનાં ઈંડાં શાંતિથી સાચવ્યાં અને ઉપર જ બેસી રહી. સામાન્ય રીતે સેવવા બેલ્લી માદા ત્રણથી પાંચ દિવસમાં એક વાર, ખોરાક પાણી લેવા ઊભી થાય છે અને અડધા કલાકમાં પાણી બેસી જાય છે. બચ્ચાનો નીકળવાનો સમય એકવિસથી ત્રેવિસ દિવસનો હોય છે.

સમય પૂરો થયો હોવા છતાં બચ્ચાં ના નીકળ્યાં, એટલે ખૂંપના આંયકાની ખરબ અસર થઈ હોય એવી આંયકા ગઈ. તુરત એક ઈંડાને લઈ સાચવીને ખોલતાં માલૂમ પડ્યું કે, કોચલું (shell) અને તેની અંદર રહેલી પાતળી ચામરી જેવું પડ (membrane) જે બન્ને એકલીજાને ચુસ્ત ચોટેલા હોય છે, તે તદ્દન છૂટો પડી ગયા હતો. આખા કોચલાની અંદરની ચામરીનો દડો તદ્દન છૂટો પડી ગયો હતો અને તે કોચલામાં ફરી શકતો હતો. તેને પણ

ખોલીને અવલોકન કરતાં માલૂમ પડ્યું કે, ઈંડાની લાવી (yolk) ને સાચવીને પકડી રાખતો અને યોગ્ય જગ્યાએ ગોક્કવી રાખતો પાતળી દેશી જેવો મજબૂત, સ્થિતિસ્થાપક, વલયાકાર અવયવ (chalaza) પણ ટૂટીને છૂટો પડી ગયો હતો. બધાં ઈંડાને તપાસતાં, બધાં જ આ રીતે નુકશાન પામેલાં જોવા મળ્યાં. મારા ઘ્યાલ મુજબ, ૨૬મીના ખૂંપ સિવાય આખો મહિનો આવેલાં પશ્ચાત કંપનો (after-shocks) થી આવું પરિણામ આવું હશે. સીધા જમીન સાથેના સંપર્કમાં રાખેલા ખોલાને કારણે પણ વધારે અસર થઈ હોય એવું લાગે છે.

તેતર, મોર, મરધાં જેવાં પક્ષીઓ જ્યારે જમીન ઉપર માળા કરે છે, એ સમય દરમિયાન જો ખૂંપ આવે તો મારા માનવા મુજબ ઈંડાને જરૂરથી નુકશાન થાય. કાયમ ખૂંપનું રહેતા પાંતોમાં આવાં પક્ષીઓની હાજરી અને વસ્તી વધવાનો આંક કેવો રહેતો હશે તે અભ્યાસ માંગી લે છે.

કૌશિક કિશ્ચીયન

ઇશાવાસ્યમુખ સોસાયરી, રાખીપ, અમદાવાદ ૩૮૨૪૮૦

\*\*\*

### નળ સરોવરમાં પક્ષીનિરીક્ષણ

\* ચેતવા (Garganey) નળ સરોવરમાં સૌ પ્રથમ આવે છે. તા. ૮-૪-૨૦૦૧ના રોજ મે તેને છેલ્લી ઓઈ હતી, તે પછી ફરી ૫-૮-૨૦૦૧ના રોજ ઓઈ. આમ માત્ર ૪ મહિના તે બહાર રહી. આ બતક આટલી મોડી જઈ રહેલી કઈ રીતે પાછી આવી શકતી હશે? તેઓ પ્રજનન, આ સમયગાળામાં પૂરું કરી દેતી હશે? (તમે તા. ૮-૪-૦૧ના છેલ્લી જોયેલી ચેતવાની પહેલાં કેટલીએ ચેતવા અહીંથી નીકળી ગઈ હોય. તેમાંથી જેમનું પ્રજનન પતી ગયું હોય તે વહેલી આવી હોય. - લા.)

\* હાલમાં (અપ્રિલ, ૨૦૦૧) નળસરોવરમાં આશરે ૧ લાખ જેટલાં નાનાં હંજ (Lesser Flamingo) છે (૩-૫-૨૦૦૧નો પત્ર). આ ઉપરાં, વિશેષ નિરીક્ષણમાં, મોટા હંજ (Greater Flamingo) -૫૦૦, ગુલાબી પેણ (Rosy Pelican)-૨૦૦૦, સેકડોની સંખ્યામાં કાળીપંદું ગડેરા (Blacktailed Godwit), ચેતવા (Garganey) -૧૦૦, કાયબરંગી (Turnstone)-૨, વગેરે ૪-૫ દિવસના ગાળામાં જોયાં.

કાસમ સમા

વકરિયા, વાયા સાંકંદ, તા. વિરમગામ, નળસરોવર ૩૮૨૯૫૦

\*\*\*

## નિર્વિક્ષણ નોંધ

### નળ સરોવરમાં પક્ષીનિરીક્ષણ

૬-૩-૨૦૦૧ના રોજ નળ સરોવરની મુલાકાત વીધી ત્યારે, નીચે મુજબનાં પક્ષીઓ નોંધાં.

ભગતડા (Coot) -૪૦૦, કાશીપુંછ ગડેરા (Black-tailed Godwit) -૫૦૦, નાના તેજપર (Small Pratincole) -૧૦૦, નાની કંકણસાર (Glossy Ibis) -૨૨, ગુલાબી પેણ Rosy Pelican) -૨૦૦ (ઉડતાં), વગેરે.

### વડોદરા ખાતે પક્ષીનિરીક્ષણ

વડોદરામાં પ્રતાપનગરની 'રેલવે લાઈન' ને સમાંતર લાલબાગ આવેલો છે. બગીચાની ઉત્તરે ચાર રસ્તા આવેલા છે. ત્યાં, 'રેલવે લાઈન'ની પાછળ ગંડા પાણીનું મોટું ખાબોચિયું આવેલું છે. આ ખાબોચિયું જંગલી વેલા તથા અન્ય વનસ્પતિથી ઢંકાયેલું હોય છે. ત્યાં મેં કાળા જલમાંજર (Bronzwinged Jacana) -૧૬, નીલમુરુથા (Purple Moorhen) -૨૨, નાનીસિસોટી બતક (Lesser Whistling Teal) -૬૦, વગેરે પક્ષીઓ જોયા (ક્યારે? -સં.).

### 'સ્વીમીંગપુલ'ના સાથીઓ!

રાજકોટમાં 'રેસકોર્સ' ભાગમાં નગરપાલિકાનો સ્નાનાગાર આવેલો છે. આ સ્નાનાગાર બંધ છે પરંતુ, અંદરની જાળીની જાળવણી માટે તેમાં થોટું પાણી ભરી રાખવામાં આવે છે. આ સ્નાનાગારમાં મેં નીચે મુજબનાં જુદાં જુદાં અનેક પક્ષીઓ જોયાં છે.

નાનો કાળિયો (Little Cormorant), દોર બગલો (Cattle Egret), થેતપુંછ તુતવારી (Green Sandpiper), સફેદછાતી કલકલિયો (Whitebreasted Kingfisher), રિટોરી (Redwattled Lapwing, ક્યારેક ૧૫થી ૨૦ની સંખ્યામાં) વગેરે.

આ સ્નાનાગાર પાસે એક વ્યાયામશાળા આવેલી છે જેના પ્રાંગણમાં અનેક વૃક્ષો છે. વ્યાયામ શાળામાં એક પંખા ઉપર હોલા (Ring Dove) એ ઠીડાં મૂક્યાં. ભૂલમાં પંખો ચાલુ થતાં તે ફૂટી ગયાં. અઠવાડિયા પછી કસરતના એક પ ફૂટ ઊંચા સાધન પર તેણે ફરી ઠીડાં મૂક્યાં. અહીં માણસોની અવરજનર રહેતી હોવા છતાં પક્ષી ઠીડાં સેવવા બેસી રહે છે. આસપાસ આટલાં વૃક્ષો હોવા છતાં હોલાએ માણસોની વચ્ચે કેમ ઠીડાં મૂક્યાં હશે? (વધારે સલામતી ખાતર હોઈ શકે. - લા.)

### અશોક મકવાયા

૧૮, લક્ષ્મીવાડી, ગુરુકૃપા પાસે, રાજકોટ, ૩૬૦૦૦૨

\*\*\*

લિંગ ૧૪

### ભાવનગરમાં પક્ષીનિરીક્ષણ

તા. ૪-૧-૨૦૦૧ થી ૬-૨-૨૦૦૧ દરમિયાન રૂવાની સીમમાં, એક ચોક્કસ ખેતરની વાડે સવારે ઉથી ઈની વચ્ચે હું એક કાબરો પિદ્દો (Pied Bushchat) જોતો હતો. તેની જીવત પકડવાની રીત સંપૂર્ણપણે માખીમાર (Flycatcher) જેવી હતી. હવામાં એક નાનકડી ઉડાન ભરીને પાછો એક જ જગ્યાએ આવીને બેસતો. ઝૂટી (Warbler)-ની જેમ પુંછડી થોડી થોડી હલાવા કરતો. તેનો અવાજ ખૂબ જ મીઠો હતો. ચાંચ ખુલ્લી કે બંધ રાખીને તે સુદર અવાજ કાઢી શકતો. હું એક જ પક્ષી જોતો.

રૂવા ગામ પસેના મંદિરમાં ભક્તો જે ચણ નાખે છે, તે ખાવા માટે આવતાં પક્ષીઓનું ચિત્ર રોજ બદલાય છે. અત્યારે (૪-૨-૦૧નો પત્ર) સૌથી વધુ વૈયા (Rosy Pastor) હોય છે. મંદિરના પ્રાંગણમાં ચણ ખાવા ટેવાઈ ગયેલાં આ વૈયા, સવારે ૭-૩૦ વાગ્યાથી મંદિરની સામેના વીજળીના તાર ઉપર હારબંધ ગોઠવાઈ જાય છે.

હું સવારે ફરીને આવું પછી, મારા ઘરે શિકા ઉપર રોટલી / ભાખરી નાખું ત્યારે, અંબાની ઉપલી ડાળે બેઠેલી કોયલની ચહીલપછી જોવાની મજા આવે. કોયલ કડક રોટલીના ટુકડા પાણીમાં બોળીને ખાય છે. 'મની પ્લાન્ટ'ના પાન ઉપર જામેલાં પાણીનાં ટીપાંમાં કે નળ નીચે ટપકતાં પાણીમાં નહાતા દરજાને જોવાની પણ ખૂબ મજા આવે છે.

રજી એપ્રિલ, ૦૧થી કુંજ (Common Crane) તથા કરકરા ( Demoiselle Crane) દેખાતા બંધ થયા છે. વૈયાની સંખ્યા પણ ઘરી છે. ઉંમી માર્યથી રૂવાની વાડીમાં મોટા કશ્યા (Large Cuckoo-Shrike)ને, સવારે પીપળાની પેપડી ખાવા આવતાં જોઉં છું. ૧૦મી એપ્રિલે રૂવાની સીમમાં તલિયા તેતરને ( Painted Partridge) બોલતો સાંભળ્યો. મારા 'પ્લોટ'માં, મોરની આઠ પંખીની ટોળી બપોર ગાળવા આવે ત્યારે, મોર તથા ડેલ, જે રીતે કૂતરાં ખાડો ખોદીને બેસે છે તે જ રીતે છાંયડો હોય ત્યાં, પગથી ખાડો ખોદી, કૂતરાની માફક જ જીબ બહાર રાખી બેસે છે.

નવીની ભક્તિ

૫૦૨-૨૪, લક્ષ્મીવાડી, બેંક સોસાઇટી, અંદ્રેપ્રેમ ચેન, ભાવનગર-૩૬૪૦૦૧

\*\*\*

## નિર્દેખણા નોંધ

### **Pelicans in Anand territory**

Seen Rosy Pelicans flying over the agriculture field in Gamadi village, 2 Kms away from Anand at 10-40 a.m. (Mailing date : 15 Apr., 2001) An unfortunate arrival due to scarcity of water and feeding ground in some other areas ? A new or first record for Anand territory ?

**Hiren Soni**

Research Biologist - Guj. Inst. of Desert Ecology  
(GUIDE) E-Mail add : hirensoni@yahoo.com

+++

### **'સિલીગ ફેન' પર બુલબુલનો માણો**

મે, ૨૦૦૧ના પહેલા અઠવાડિયામાં, અમારા પાંચમા માળે આવેલા એક ઓરડામાં 'સિલીગ ફેન' ઉપરથી સણીઓ પડતાં ધ્યાન ગયું કે, બુલબુલની એક જોવા ત્યાં માળો બાંધી રહી છે. મેં ત્યાં પગરાંનું એક ખોયું બાંધી દીયું. પક્ષીઓએ તે સ્વીકારી દીયું. જુનના પહેલા અઠવાડિયામાં ત ઈડાં મુક્કાં, છેલ્લાં અઠવાડિયામાં ઈડાંમાંથી બચ્યાં બહાર આવ્યાં.

**પ્રદીપ ઘોટાલ**

૭-૧-૨૧, વિક્રમનગર, 'દિક્ષિયે' ક્રેનેમ્સી, આમલી, બોપલ ડેટ, અમદાવાદ-૪૮.

+++

### **નીલપુંછ પતરંગા(Bluetailed Bee-eater)ના માણો**

'ગીર ફાઉન્ડેશન'ના શિકારી પક્ષીઓના સર્વેક્ષણ અન્વયે તા. ૬-૬-૨૦૦૧ના રોજ ઉત્કઠેશર - કપડવંજના માર્ગ પર જવાનું થયું. આ દરમિયાન અમે નીલપુંછ પતરંગાના ધણાં માળા જોયા. વાત્રકના કોતરોમાં એક જગ્યાએ પાંચ-છ ચાલુ માળા હતા. અમે પક્ષીઓને જીવડાં પકડતાં અને ત્યાર બાદ, માળામાં જઈ બચ્યાંને ખવડાવતાં જોયા. આ વિસ્તારમાં, વાત્રકના કંઠે, સણંગ અમે આ પક્ષીની હાજરી નોંધી અને એવી ધારણા કરી શકાય કે, એ સિવાય પણ, કોતરોમાં વધુ માળા હોઈ શકે. આ પક્ષીની પ્રજનન અંગેની પૂરતી નોંધ નથી એ જોતાં આ માહિતી અમને ઉપયોગી લાગી.

**પણાવત્રીવેદી/ચિન્મય શુક્લ**

૧૮, સુપ્રોપલ ફેલેટ, રામદેવનગર, અમદાવાદ-૩૮૦૦૧૫

+++

### **અમદાવાદમાં માળા વસાહતો**

વસ્ત્રાપુર ગ્રામ પંચાયતના મકાનની બહાર મોટા

લિંગં ૧૫

વડના વૃક્ષ ઉપર ઢોર બગલા (Cattle Egret)-ની માળા વસાહત, જુલાઈના અંતથી ઓગસ્ટની શરૂઆત સુધી જોવા મળેલ છે. હાલ પણ પક્ષીઓ બચ્યાં ઉછેરી રહ્યાં છે. લગભગ ૨૨ માળા છે.

સાબરમતી 'ડી' કેબીન 'બસ-સ્ટોપ'ની બાજુમાં શાકબજાર પાસે અને બીજી બાજુ રેલવે ટ્રેક છે, ત્યાં બાવળના સાત વૃક્ષ ઉપર નાના બગલા (Little Egret) અને ઢોર બગલાની માળા - વસાહત જુલાઈથી ઓગસ્ટ દરમિયાન જોવા મળી. સણંગ બાવળના વૃક્ષો છેરીને બીજાં ચાર વૃક્ષો પર માળા જોવા મળે છે. બધાં સાત વૃક્ષના માળા કુલ થઈને ૪૦ જેટલા છે. અગાર દ્વારા પક્ષીઓને હેરાન થતાં પણ જોયાં. માર્ગસોની અવરજ્ઞવરથી પંખી હેરાન થતાં નથી. આ વસાહતથી આગળ લગભગ ૧.૫ ક્રિ.મીના અંતરે એક તણાવ આવેલું છે.

કાર્ટિક શાસ્ત્રી

અશોકવાડી, પંચવટી, અમદાવાદ

+++

### **સુરત શહેરમાં કચ્છી પિંડો**

હું સુરત શહેરના પાંશુમ વિભાગના છેડા પર રહું છું. સાતેક વર્ષ થયાં, કચ્છી પિંડો (Brown Rock Chat) નિયમિત જોઉ છું. વહેલી સવારે તેને ગાતાં પણ સાંભળું છું. ખાસ કરીને બિનવપરશવાળા અધૂરા બાંધેલા મકાનની બાજુબાજુ જોવા મળે છે. અત્યાર સુધી એક જોવા મળતી હતી, પણ હમણાં હમણાં બે જોડી અલગ અલગ જોવા મળે છે. નવાં બાંધકામ અને વસ્તીનું પ્રમાણ વધે છે તેમ આ પક્ષી શહેરના છેડા પર ઓછી વસ્તીવાળા વિસ્તાર તરફ સ્થાનાંતર થયેલાં જોવા મળે છે.

### **સુરત શહેરમાં રાજીપીપળાના પોપટ**

મારી કોલેજ, શહેરની લગભગ વચ્ચે છે. આજુબાજુ સિમેન્ટ, ક્રોકીટનું જંગલ છે, પરંતુ કોલેજમાં પંદરથી વીસ સારાં વૃક્ષો હોવાથી હમણાં હમણાં છાંચેક મહિનાથી રાજીપીપળાનો પોપટ (Alexandrine Parakeet) બેથી ચારની સંખ્યામાં જોવા મળે છે. ખાસ કરીને વૃક્ષોની ટોચ પર બેસે છે. એ રીતે બેસે છે કે, આપણે તેને સહેલાઈથી જોઈ શકીએ નથી, અવાજ પરથી તેની હાજરી તુરત જ પરબાય.

અનિલ અન. ભડ્ક

અ-૩, હાઈક પાર્ક, નવુંગ કોલેજ પદ્ધતિ, જોગાડી નગર પાસે, રાંસેર રોડ, સુરત-૯

+++

## નિર્ક્રિક્ષણ નોંધ

### કુલીયારી, ૭૫-૦૦ રૂ. નંગ

૧૫ દિવસ પહેલાં હાંસોટના મથ્છી- બજારમાં બે કુલીયારી (આ ગુજરાતી નામ છે અને વધારે પ્રચલિત છે)ને રૂ.૭૫/- નંગના ભાવે વેચાતી જોઈ. જ્ઞાવા મળ્યું કે, કુલીયારી (પ્રલિલી, Eastern Curlew) અને બળાં (ફંજ, Flamingo) ત્યાંની માર્કેટમાં સામાન્ય રીતે આવે છે.(આ એક માહિતી છે, કોઈ ઉર્ધ્વ-શોક નથી).

### ભવભૂતિ પારશાર્ય

ગુજરાત એગ્રિકલ્યુર યુનિવર્સિટી, આસંડ ૩૮૮૯૯૦

+ + +

### ટપકીલી મુનિયા (Spotted Munia)નો માળો

તા. ૨૫-૮-૨૦૦૧ સવારમાં ૮-૩૦ વાગે, હું અને સપના સુરેન્દ્રનું જાંબુઘોડા જગલના નારુકોટ વિસ્તારમાં પકીનિરીક્ષણ દેતુથી ફરી રહ્યા હતાં. તે દરમિયાન અમે ત્યાં પહાડોની વચ્ચે આવેલા એક ચેક ડેમ પાસે, એક ખાખરાના ઝાડ ઉપર કોઈ પકીનો અવાજ સાંભળ્યો. અમે અમારું દૂરબીન તે તરફ માર્ગયું, તો આશ્રમ વચ્ચે ત્યાં ટપકીલી મુનિયાને માળો કરતાં જોઈ. અદની ઊચાઈ લગભગ ૧૫ ફૂટ હતી અને માળો પાંડાઓની વચ્ચે ડાળીના ચિપિયામાં આશરે ૧૨ ફૂટ ઊચાઈએ હતો. અમે જોયું કે, ને મુનિયામાંથી માત્ર એક જ મુનિયા માળા માટે ધાસ (લીલુ) લાવતી હતી, જ્યારે બીજી, દૂર ઝાડ ઉપર બેસી બધું શાંતિથી જોતી હતી. અમે થોડું નજીક જઈ નિરીક્ષણ કર્યું તો માલુમ પડ્યું કે, માળો ગોળાકાર અને લગભગ ૧૫ સે.મી. વાસનો હતો. મધ્યમાં ગોળાકાર પ્રવેશદાર પંશ હતું. માળાને બહારથી પાતળા ધાસ વડે અને અંદરથી પહોળા અને લીલા ધાસ વડે બાધ્યો હતો. અંદરથી ખબર એટલે પડી કે, પકી પહોળું ધાસ લાવીને અંદર જતું રહેતું અને ધાસને ગોળાકારે અંદરથી પાથરતું હતું.

### સપના સુરેન્દ્રનું/વિરેન્સિંહ અલા

૨૫/શે, કલ્યાણનગર, વાંદોડા રોડ, વડોદરા-૩૮૦૦૧૮

+ + +

### અમદાવાદમાં રાજીપળાનો પોપટ (Alexandrine Parakeet)

‘વિહુંગ’ના સંલંઘ અંક ૭ (શિશિર-૨૦૦૦)માં એલ.ડી.એન્જિનિયરીંગ હોસ્પિટની પાછળ મને જોવા મળેલા

રાજીપળાના પોપટ વિશેની ટૂંકી નોંધ આપે કરી હતી, તેના અનુસંધાનમાં જ્ઞાવવાનું કે, આ જાતનો પોપટ મને ફરી એક વાર, તા. ૩-૬-૨૦૦૧ના રોજ ‘સેટ એવિયર્સ કોલેજ’ પાસેના ચાર રસ્તાની નજીક આવેલી નર્સરી સ્કૂલ ‘ડિસ્ક્રેપ્સ’નજીક જોવા સાંભળવા મળ્યો. મારા પુત્રને શાળામાં મૂકવા જતો હતો ત્યારે, માથા ઉપરથી રાજીપળાના પોપટનો વિશિષ્ટ વેરો અને બુલંદ અવાજ સંભળાયો. મેં ઉપર જોયું તો માથા ઉપર, ધંડો ઊંચે ઇલેક્ટ્રિસીટીના બે જ્ઝડા તાર પસાર થતા હતા, તેમાંના એક પર આ પોપટ બેઠો હતો. તેને નીચેથી જોયો અથી ખભા પરનું લાલ લાખું જોવાને અવકાશ નહોતો, પરંતુ, તેના મોટા કદ અને મોટા અવાજ પરથી તે રાજીપળાનો પોપટ હોવા વિશે શંકા રહી નહીં. સમય હતો સવારના ૧૦-૦૦ વાગ્યાનો.

### ટપુસિયા (Whitethroated Munia) નું મોટું ટોણું

૨૭ મે, ૨૦૦૧ના દિવસે સાંશેદ-નજસરોવરના રસ્તે આશરે સાડા ત્રણ વાગ્યે પસાર થઈ રહ્યો હતો. તે દિવસે ભયાનક વાવાજોડાનાં અંધાણ હતાં અને પવનનું જોર ખરેખર અસામાન્ય હતું. લેંબા ગામ પસાર કર્યા પછી એક કાંટાળા કુપ ઉપર નાનકડાં પંખીઓનું મોટું ટોણું જોવા મળ્યું. વાહન ઊંચું રાખી જોતાં જ્ઞાવ્યું કે, ટપુસિયાની સંખ્યા ૪૨ની છે. તેઓ એક જ નાના કુપ પર બેઠેલાં જોવાની તથા તેમનો મીઠો કલબલાટ સાંભળવાની મોજ પડી!

કેતન ટાકુ

અ/૩૧, ગોપલ ટાવર, ગુલબાઈ ટેકરા, અમદાવાદ ૩૮૦૦૧૫

+ + +

### અબાબીલના માળા : મંદિરોનું વિશેષ આકર્ષણ !?

તા. ૧૮-૫-૦૦ના રોજ ઉદ્પેરથી આવતાં દર્શનાર્થી શામણાજી મંદિર રોકાતાં, નજીકની ધર્મશાળાના પ્રવેશમાળની છત ઉપર અબાબીલ (House Swift)ના એકબીજાને અડોઅડ સામટા માળાઓનું નાનું નગર વસેલું જોવા મળ્યું. ટોળાંખું પકીઓને હવામાં અવાજ કરતાં, ઝડપી ચકરાવા લેતાં જોવામાં ખૂબ આનંદ મળ્યો. ધાર્મિક તીર્થ સાથે ‘પકી તીર્થ’ નામ તરી આવ્યું. વિશિષ્ટ પકી અચૂક જોવા મળતું હોય તેવાં સ્થળોને પકી તીર્થ કહી શકાય ! આવાં ‘પકી તીર્થો’ની યાદી ગુજરાત પૂરતી કેમ પ્રસિદ્ધ ન કરી શકાય ?

તા. ૩૦-૬-૦૧ના રોજ ચાંદોદ મુકામે, શેખ

## નિર્વિક્ષણ નોંધ

નારાયણ મંદિરના પ્રવેશની છતમાં આ જ પક્ષીઓના માળાઓ જોયાં.

(અંબાજી, જિ. સાંબરકાંઠાના મુખ્ય મંદિરના મંડપની છત ઉપર તા. ૫-૮-૨૦૦૧ના રોજ મે અભાબીલના માળા જોયા. મંદિરોના મંડપવાળા ભાગની ઊંચી છત, તેનો ક્યારેક કોટરણીવાળો ગુંબજીકાર આ પક્ષીને માળા કરવા વિશેષ આકર્ષિત કરતો હશે? કે કોઈ અન્ય પરિબળ હશે? - સ.)

તા. ૧૨-૧૦-૨૦૦૦ના રોજ ડાકોર જતાં પણસોરા ઉપર ૧૦૦+ ગુલાબી પેણ (Rosy Pelican) મંડરતી જોઈ. બે દિવસ પછીના 'સંદેશ' માં નજીકના ખંભોળજ તણાવમાં 'મોટાં પક્ષીઓ' ની નોંધ હતી. તા. ૩-૩-૦૧ના રોજ આંણંદાંભવેલ નજીક ૩૦+ ગુલાબી પેણ જોઈ.

તા. ૫ અને ૬-૦૧ના રોજ સાંજે ધાબા ઉપર જતાં, હજારોની સંખ્યામાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વૈયાં (Rosy Pastor) ના કલબલાટ કરતાં ટોળાં જોયાં. પ્રથમ વખત આટલી સંખ્યામાં જોયાં! આકાશ આપું છવાઈ ગયું હતું. દક્ષિણ કષાર્ટકમાં નવેમ્બર ૨૦૦૦માં મોટી સંખ્યામાં વૈયા જોવાના કારણોમાં ગુજરાત, પૂર્વ અને મધ્ય મહારાષ્ટ્ર તથા ઉત્તર કષાર્ટક અને અંત્રપ્રદેશમાં અછતથી પરિસ્થિતિ કારણભૂત બતાવે છે ("The year of the Rosy Pastor" તેજસ્વી એસ., N.L.B.W. Vol 41 No.3. May - June 2001)

(વળતી મુસાફરીના સમયે વૈયાનું હજારોની સંખ્યામાં લેગા થતું અને પછી ઊરી નીકળતું, એ સામાન્ય ઘટના છે. - લા.)

ડૉ. એસ. સી. વશિષ્ઠ

૨/૩, પંચાયતની, વિશન રોડ, નડિયાદ ૩૮૭૦૦૨

+++.

### લખતર વીડીમાં તલિયો તેતર

તા. ૧૨-૭-૦૧ના રોજ ભારા ભિત્રો યોગેન્દ્ર શાહ તથા ફારુક ચૌહાણ સાથે લખતર વીડીમાં પક્ષીનિરીક્ષણ માટે ગયા હતા. ત્યાં અમે ત તલિયા તેતર (Painted Partridge) જોયાં. અમારા વિસ્તારમાં આ પક્ષી ક્વચિત્ જ જોવા મળે છે. છેલ્લાં બે વર્ષમાં અમે પહેલી વાર જોયું. આ ઉપરાંત અમે એક તુરુમ્તી (Redheaded Merlin) પણ જોઈ.

ચીકુવોરા

લક્ષ્મીપુરા, દુર્ગરેણ રોડ, સુરેન્દ્રનગર ૩૮૭૦૦૨

+++

### તુરુમ્તી (Redheaded Merlin)નો માળો

તા. ૨૫-૪-૦૧ના રોજ મૂળી-સુરેન્દ્રનગર માર્ગ ઉપર એક પીપળના વૃક્ષ ઉપર તુરુમ્તીનો માળો જોયો. માળામાં બે બચ્ચાં પણ જોયાં. બીજે દિવસે મારા ભિત્રો ચીકુ વોરા, તથા યોગેન્દ્ર શાહ સાથે ફરી અમે આવ્યા. બચ્ચાં માળામાં ન હતાં. તપાસ કરતાં, તેમને જાડ નીચે જીમીનના ખાડામાં લપાઈને બેઠેલાં જોયાં. અમને થયું કે, બચ્ચાંને જોખમ છે, એટલે માળો ખૂબ ઊંચે હોવા છતાં સાચવીને બચ્ચાં ફરી માળામાં મૂક્યાં. ત્રીજી દિવસે જોયું તો એક બચ્ચાં રસ્તા પર મરેલું હતું. કદાચ પડી ગયું હોય અને વાહનની હડ્ડેટમાં આવી ગયું હોય. બીજું બચ્ચાં માળામાં હતું. પાંચ દિવસ પછી બચ્ચાં સાથે પક્ષીઓ માળો છોડી જતાં રહ્યાં હતાં.

ફારુક ચૌહાણ

લક્ષ્મીપુરા, દુર્ગરેણ રોડ, સુરેન્દ્રનગર ૩૮૭૦૦૨

+++

### મોરનાં બચ્ચાંની પાલક માતા, મરધી

તા. ૧૭-૮-૦૧ના રોજ રાજ્યભાઈ મહેતાનો ફોન આવ્યો હતો કે આલાવાડ કલબની બાજુમાં ઢેલે ચાર ઈંડા મૂક્યાં છે, જેમાંના બે વહેલી સવારે બિલાડીએ શોરી નાંખ્યાં છે. વળી, તેણે ઢેલને પણ ધાયલ કરી છે. હું, ચીકુ વોરા, ફારુક ચૌહાણ, હર્ષલ શાહ વગેરે સ્થળ પર પહોંચી ગયા. બાપોર સુધી રાહ જોઈ પણ ઢેલ ત્યાં આવી નહીં. આલાવાડ કલબના ચોકીદારને બાકીનાં બે ઈંડાનું ધાન રાખવા તથા ઢેલ પાછી ફરી છે કે નહીં તે જોવા જણાયું.

બીજે દિવસે સવારે ચોકીદારે જણાયું કે ઢેલ રાતે પણ પાછી ફરી નથી. અમે એ ઈંડાં માળામાંથી લઈ લીધા અને એક ઈંડાં પર બેસતી મરધી પાસે સેવડાયાં. આ મરધી ચીકુવોરાની પાસે રહેતા શાન જ્યપુરીની હતી. તા. ૨૦-૮-૦૧ના રોજ ૧૨-૩૦ વાગ્યે પહેલાં ઈંડાંમાંથી બચ્ચાં નીકળ્યું અને ૧-૩૦ વાગ્યે બીજું. આ બચ્ચાં હાલમાં ફારુક ચૌહાણને ત્યાં રાખેલાં છે અને તેની સારસંભાળ બચ્ચાંની પાલક માતા મરધી લઈ રહી છે.

યોગેન્દ્ર શાહ

'આનંદ', અભૂતનાથ સો. પાસે, જાગ્રાત રોડ, સુરેન્દ્રનગર ૩૮૭૦૦૨

+++

## વાંદરા પર વધુ ભરોસો !

બાવળના જાડ પર કાગડાના માળા પાસે જ ડાળ પર વાંદરો બેઠો હતો, પણ કાગંપતી તેને ચાંચસરખી અડાડતાં ન હતાં. હા ! બાવળ નીચેથી પસાર થતાં માણસને જરૂર ચાંચથી પ્રહાર કરતાં હતાં. શું માણસ કરતાં વાંદરા પર તેમને વધુ ભરોસો હશે? એથી ઉલટું, ટિટોડી વાંદરાને ચાંચ-પ્રહાર કરતી જોવા મળી.

બાસીલ મેકવાન  
બોરસાન

\*\*\*

## ગુલાબી પેણ - જમણની અનોખી રીત

માર્ચ-૨૦૦૧માં ભૂકુંપ સર્વેની કામગીરી માટે ભુજ ખાતે ફરજ પર રહેવાનો મોકો મળ્યો. દરરોજ શહેર વચ્ચેનાં હમીરસર તળાવ પાસેથી વાહનમાં પસાર થતાં, તળાવમાં ૧૦થી ૧૨ ગુલાબી પેણ અને અન્ય બતકો નજરે પડી જતાં. સાથે દૂરબીન ન લાવ્યાનો અફસોસ પણ થતો. એક બાજુ ભૂકુંપની ભયાનક પરિસ્થિતિથી મન વ્યાકુણ હતું. તેવા સંજોગોમાં પણ તળાવનાં પક્ષીઓ નિરાંતે નજીકથી જોવાનું કૃતુહલ ઊભરાતું હતું. તા. ૧૮-૩-



૦૧ની ભરબાપોરે ૨-૩૦ વાગ્યે નવરાશ મળતાં, તળાવ વચ્ચેનાં બગીચામાં જઈ પહોંચ્યો. બે પેણ છીછરા પાણીમાં કંઈક જુદી રીતે પ્રવૃત્ત નજરે ચીરી. બતકો જેમ ઊધા માથે શિર્ખસન કરી ખોરાક મેળવતી હોય છે, તેમ પેણ કરતી હતી. બન્ને પાંખો ખુલ્લી રાખી, સમતોલન જીળવી, પગ વડે હવેસાં મારી, સમાંતર આગળ ધપતી હતી. ક્યારેક વચ્ચે ચાંચ સપાટી પર લાવી, ડાંબથી જમજે વળાંકદાર રીતે પાણીમાં ઉડે પસાર કરી લઈ જતી હતી. આ સમયે

ચાંચ ખુલ્લી રાખી ચાંચ નીચેની ચામડીની થેલીમાં નાની માછલીઓ કે અન્ય ખોરાક પકડતી હોવી જોઈએ. ભુજ ખાતે મ. કુ. શ્રી હિંમતસિંહજી બાવાને મળવાની તક સાંપદતાં, તેમને આ વાત જણાવી. તેમજે પણ પેણની આ અનોખી રીત જવલે જ દેખાય છે, તેમ જણાવ્યું.

## રાજકોટ આસપાસ

આમ તો વર્ષ ૨૦૦૧નો ઉનાળો નપાણિયો હતો. સૂકાં જળાશયો હોવાથી રસવિહીન લાગતો હતો, પરંતુ રાજકોટની કાઈસ્ટ કોલેજમાં અભ્યાસ કરતા ઉત્સાહી, તરવરિયા પક્ષી-નિરીક્ષક વિદ્યાર્થીઓએ વેકેશનનો સફુપ્યોગ દરરોજ પક્ષીનિરીક્ષણની રખડપદ્ધીમાં કર્યો. સાથે ક્યારેક મને પણ બેચ્યો. રાજન જાદવ, રાજકીય જાલા અને અમીત પારેખની સાથે કરેલાં નિરીક્ષણો આ મુજબ છે.

તા. ૨૪-૪-૦૧ના રોજ નજીકની ખિરસરા વીરીમાં ફરતાં રાજને કહું કે, તેણે અગાઉ મોટા ધુવડ (Great Horned Owl)ની જોડીને વીરીની બહાર, રસ્તા તરફના ભાગમાં જોઈ હતી. ત્યા જઈ ખડકાળ વિસ્તારમાં પહોંચતા જ તે ધુવડની જોડી ઊરી અને થોડે દૂર બાવળ પર અમોને જોડી બેઠી. મેં રાજનને સૂચયું કે, સાંજે નજીકમાં એક જગ્યા એ બેસશો તો તેનો માળો-બ્ખોલ મળી આવશે. એક દિવસ તેઓએ ત્યા ચાત્રિનાં ૧-૦૦ સુધી રોકાઈ દર શોધ્યું અને એક પુઢું બચ્યાંને જોયું. દર પાસે પડેલ ચરકમાં ઉદરના અવશેષ પણ નોંધા.

રાજકીયનો ફોન આવ્યો કે, તેના ઘરની નજીક તુરમ્ભી (Redheaded Merlin) વિદ્યુતના થાંબલા પર સવારે ૭-૦૦ વાગ્યે અને સાંજે પણ ચોક્કસ સમયે આવીને બેસે છે. તા. ૭-૬-૦૧ની વહેલી સવારે જેતર નજીકના રહેણાંક વિસ્તારમાં પહોંચતાં જ તુરમ્ભીની ઝડપી ઊડાન સાથે તીક્ષ્ણ ટૂંકો અવાજ સાંભળ્યો. તે કાગડાને ભગડતી તેના નિશ્ચિત સ્થાન, વિદ્યુતના થાંબલે જઈ બેઠી. થોડીવારમાં અન્ય બે પક્ષી પણ આવ્યાં. નજીક જતાં વિકેપ ન પામ્યાં. નજીકથી નિછળતાં તેના માથા પર લાલને બદલે બદામી રંગ જગ્યાયો. આર. એસ. ધર્મકુમારસિંહજીએ ‘બર્જ ઓફ સૌરાષ્ટ્ર’માં લખ્યું છે કે, તુરમ્ભી (માદા) અને ચતવો (નર) જોડીમાં વહેલી સવારે અને સુધ્યારસ પહેલાં સાથે શિકાર કરતાં, પ્રજનન અનુસિવાય પણ સામાન્ય રીતે જોવા મળે છે.

► રાજન - રાજદીપે ફરી સમાચાર આપ્યા કે, આજુ-  
રે તેમ નીચે નદીના પટમાં સુરંગી પાનબગલી (Chestnut  
Bittern) જોઈ. તેમાં પાણી બિલકુલ ન હોવાને કારણે ત્યાં  
ચિયા પણ ખાસ મોટાં ન હોય તેવું વિચારતાં તેના આગમનની  
નવાઈ લાગી. તેની ખરાઈ માટે તા. ૮-૬-૦૧ની વહેલી  
સવારે ઉપડ્યા. રસ્તાની આસપાસનો વિસ્તાર થોડાં  
વરસાદની છાલકથી તાજો અને સુંધરી હતો. વરસાદને કારણે  
બહાર નીકળી આવેલ પાંખાણાં કીટકો ઉડતાં હતાં. બુલબુલ  
અને થોરિયા લેલાં પણ તકનો લાભ લઈ તેને હવામાં  
પકડતાં હતાં. ટેચીપુંછ તારોડીયાની (Wiretailed Swallow)  
જોડી જીવાં પકડતી નાળા પાસેનાં બાવળિયે બેઠી.  
નાળાના પાઈપની છતમાં માટીની જીણી ગોળીઓ, તણખલાં,  
પીછાં જોડી બનાવેલો, ચંબુ આકારનો, નળાકાર પ્રવેશદ્વાર  
ધરાવતો તેનો માળો જોયો. નદીના પટમાં તેમ પાસેથી પસાર  
થતો પાઈપ 'લિકેજ' હોવાને કારણે થોડું પાણી હોવાથી  
પાનફૂટી તથા નાના ચિયા ઊગેલાં હતાં. પાન-સુગરીઓ  
(Blackthroated Weaver) ચિયા બેગાં કરી માળો બનાવતી  
કલબલ કરતી હતી. શેતપંખ જલમાંજર (Pheasant-tailed  
Jacana), તપકીરી સંતાકુકડી (Brown Crake), રાત  
બગલો (Night Heron), નડીબગલો (Purple Heron), સર્ઝિં  
છાતી સંતાકુકડી (Whitebreasted Waterhen), વગેરે  
પક્ષીઓ પ્રવૃત્ત જોયાં. પાનલવા (Painted Snipe)-ની એક  
જોડી દૂર ઘાસમાં ચરતી જોઈ. અને હા, એક સુરંગી પાન  
બગલી પણ અચાનક પાનફૂટીમાંથી ઉડતી નિહાળી. તેનું  
અને પાનસુગરીઓનું આગમન વહેલું લાગ્યું. સામાન્ય રીતે  
જુલાઈ અંતમાં પહેલી વાર દેખાય છે. (આ બંને નિવાસી  
પણીઓ છે, સ્થાનિક હરફર હોઈ શકે. - લા.)

મે મહિનાના વરસાદથી આજુ-૧માં ખાબોચિયા  
ભરાયા જેટલું પાણી આવ્યું. ત્યાં જઈ રાજને - અમીતે કહું,  
“ હંજ બતકો આવાં છે અને તેને પકડવા કોઈ જાળ નાંબે  
છે.” તા. ૪-૬-૦૧ના રોજ અમે સાથે ગયા. ટીલીયાળી  
બતક (Spotbilled Duck), હંજ (Flamingo), નાની સિસોટી  
બતક (Lesser Whistling Teal), મોટા ચકવા (Great  
Stone Curlew) હતાં. પક્ષી પકડવાનો ફાંસલો મળ્યો.

પ્લાસ્ટીકની થોડી જાડી ઢોરીને બન્ને છેદે પથ્થરો બાંધી પાણી  
કાદવમાં નાખેલ હતી. ઢોરીમાં થોડા અંતરે પાતળી પ્લાસ્ટીકની  
ઢોરીના ફાંસલા બનાવેલ હતા. જાળ આસપાસ મરેલા ડેડકાં  
પક્ષીને આકર્ષવા નાખેલ હતાં. પાસે બેતી કરતી વિક્ઝિને  
આ જાડાવ્યું. ત્યાર બાદ, પણ રાજન-રાજદીપ ત્યાં ગયા,  
પણ કાંઈ મળ્યું નહીં. રાજકોટ આસપાસ પહેલી વાર જોવું.

અશોક મથરા

૧૫, લક્ઝેનગર સેસાયરી, રાજકોટ ૩૬૦૦૦૨

\*\*\*

### ચાતક અને વરસાદ

૪૨ વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧-૬-૨૦૦૧ના  
રોજ ચાતક દુપ્તીએ વહેલી સવારે મારા ધરની બારી પાસે  
બોલીને હાજરી પૂરાવી. બીજે જ દિવસે વરસાદ આવ્યો અને  
ખેડૂતોએ ભીમ - અગિયારસની વાવણી કરી.

ભગવાનજી અદ્વિયા  
વેરાવળ

\*\*\*

### ખીજડિયા પક્ષી અભયારણ્ય, જિ. જીમનગરમાં નાની કંકણસાર (Glossy Ibis)

‘ખીજડિયા પક્ષી અભયારણ્ય’, જીમનગરથી  
લગભગ ૧૨ કિ.મી.નાં અંતરે આવેલ છે. આ  
અભયારણનો કુલ વિસ્તાર ૬૦૫ હે. છે, જે બે ભાગમાં  
વહેચાયેલ છે. ધૂવાંવ ગામ તરફનો વિસ્તાર જે રૂપારેલ  
નદી ઉપર બાંધવામાં આવેલ બંધ (પાળા)ને લીધે દરિયાઈ  
અભયારણ્યથી અલગ પડે છે તે એક જણપ્લાવિત વિસ્તાર  
છે. જૂના નવાનગર રાજ્યમાં સને ૧૯૨૦ની સાલમાં આ  
વિસ્તારમાં એક માટીનો પાળો બાંધવામાં આવેલ, જે  
સૌરાષ્ટ્ર રાજ્યના સમયમાં સને ૧૯૮૫માં સમો કરવામાં  
આવેલ. આ પાળાની એક તરફ વરસાદનું પાણી એકહું  
થાય છે અને બીજી બાજુ દરિયાઈની ભરતીથી પાણી આવે  
છે સમય જતાં વરસાદનું પાણી થોડું ખારાશવાળું થાય છે.  
આમ ‘ખીજડિયા પક્ષી અભયારણ્ય’માં એક અલગ પ્રકારનું  
પરિસરતંત્ર રચાય છે, તેમ કહી શકાય.

અભયારણના વિસ્તારમાં ઘણી પ્રજાતિઓ

## નિર્વિક્ષણ નોંધ

પ્રજનન કરતી હોવાનું નોંધાયેલ છે. ખાસ કરીને મોટી દૂબકી અને નાની દૂબકી (Great Crested Grebe & Little Grebe) અહીં પ્રજનન કરતી નોંધાયેલ છે. આ વિસ્તારમાં જોવા મળતી માળા-વસાહત અને તેમાં પક્ષીની વિવિધ પ્રજાતિઓ દ્વારા થતું પ્રજનન અલગ તરી આવે છે. ધૂવાંવ વિસ્તારમાં બીજા નંબરના વોચ્ચટાવરની સામે આવેલ વિસ્તાર કે જેમાં ગાંડા બાવળનાં વૃક્ષોની જાડી આવેલ છે, તે વિસ્તાર 'પક્ષી બેટડી' તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં પાણીની વચ્ચે આવેલાં ગાંડા બાવળનાં વૃક્ષો ઉપર ત્રણ થી ચાર સતરમાં અલગ અલગ પ્રકારની પ્રજાતિઓના માળા આવેલ છે, જેમાં ચમચા (Spoonbill), પીળીચાંચ ડોક (Painted Stork), ઢોર બગલા (Cattle Egret), નાના બગલા (Little Egret), મોટા અને નાના કાજિપા (Large & Little Cormorants), સપ્ચીવ (Darter), રાત બગલા (Night Heron), સફેદ કંકણસાર (White Ibis) વગેરે નો સમાવેશ થાય છે.

ચાલુ વર્ષે તા. ૮-૯-૨૦૦૧ના રોજની આ વિસ્તારની મારી મુલાકાત દરમિયાન માળા-વસાહતમાં અન્ય પક્ષીઓના માળાઓ વચ્ચે નાની કંકણસારના બે માળાઓ અલગ અલગ વૃક્ષો પર જોવા મળ્યા. આ પૈકી એક માળામાં એક ચણકૃતું લીલું, ભૂંડું ઈંડું તથા એક બચ્ચું હતું, તેમજ બીજા માળામાં બે તાજાં જન્મેલાં બચ્ચાં હતાં. તા. ૨૨-૯-૨૦૦૧ના રોજ આ વિસ્તારની ફરી વખત મુલાકાત હેતાં, એક વૃક્ષ પરના બંને બચ્ચાંઓ ઊરી ગયા હતાં, જ્યારે બીજા વૃક્ષ પર બંને બચ્ચાંઓ માળામાંથી નીકળી આડશરમાં છુપાયેલાં જોવા મળેલ હતાં. બંને માળાઓ ગાંડા બાવળની ઘટામાં, પાણીથી એકાદ મીટરની ઊચાઈએ, સૌથી નીચેના સતરમાં હતા.

**સામાન્યત:** નાની કંકણસાર આપણા વિસ્તારમાં ધ્યાવાર પંખી ગણાય છે. સ્વ. ડૉ. સાલિમ અલીએ હેન્ડબુક ઓફ ધી બર્ડ્ઝ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન'ના ગ્રંથ ૧,

પાના નં. ૧૧૪-૧૧૫ પર તેને આંશિક રહેવાસી તથા આંશિક યાયાવર ગણાવ્યું છે. તેના ધૂટાછવાયા (sporadic) માળાઓ સિંધ, અવધ, ઓરિસ્સા, આસામ અને મણિપુરમાં અન્ય પાણીનાં સ્થાનિક પક્ષીઓ સાથે મિશ્ર માળા-વસાહતો (mixed heronries)માં મે થી જુલાઈ માસ દરમિયાન નોંધાયેલ હોવાનું જણાવેલ છે. ગ્રીમેટ, ઇન્સ્ક્રીપ અને ઇન્સ્ક્રીપ તેઓના 'બર્ડ્ઝ ઓફ ઇન્ડિયન સબકોન્ટ્રિનેન્ટ' ના પાના ૫૮૮ પર નાની કંકણસારનું પશ્ચિમમાં સિંધ અને કંચુથી લઈ પૂર્વમાં મણિપુર અને દક્ષિણમાં ઓરિસ્સા સુધીમાં સ્થાનિક રીતે પ્રજનન થયેલ હોવાનું જણાવેલ છે. સ્વ. ધર્મકુમારસિંહજીએ 'બર્ડ્ઝ ઓફ સૌરાષ્ટ્ર'માં, "આ પ્રજાતિનું પ્રજનન સૌરાષ્ટ્રમાં જોવામાં આવેલ નથી, જો કે તેઓ તેમ (પ્રજનન) કરતાં હોઈ શકે" એમ નોંધું છે. કેટલાક પક્ષીનિરીક્ષકોએ તુલુર ચર્ચા દરમિયાન 'દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન' ના વિસ્તારોમાં ટાપુઓ પર ચેરનાં જંગલો (Mangroves)માં થતી વસાહતો (heronries)માં આ જાતિના માળાઓની શક્તિના માટે આશા વ્યક્ત કરી છે.

ચાલુ વર્ષે 'ખીજડિયા અભ્યારણ્ય'માં જોવા મળેલ બે માળાઓ પરથી પક્ષીનિરીક્ષક મિત્રોએ દશવિલ શક્યતાઓમાં તથા હોઈ શકે એવું માનવાને પ્રેરાયેલ છું. ચોમાસા દરમિયાન દરિયો તોણાની હોવાના કારણે ટાપુઓના વિસ્તારની મારી મુલાકાતો મયાર્દિત રહે છે, પરંતુ આવતી ઋતુમાં આ બાબતે સતકૃતા દાખવી, જરૂર પડ્યે થોડું જોખમ લઈને પણ, વિવિધ માળા-વસાહતો ની મુલાકાતો લઈ આ જાતિના પ્રજનન બાબતે વધુ માફિતી એકઠી કરવાનું વિચારણ છું.

સુરેશ જાની  
નાયબ વનસ્પતિક, 'દરિયાપી રાષ્ટ્રીય ઉદ્યાન', અમનગર



**પ્રકૃતિ મિત્ર મંડળ,** દાહોદ દ્વારાતા. ૨૨-૨૩-૨૪/૧૧/૨૦૦૧નાં શુક્ર-શનિ-રવિ દરમિયાન, ગુજરાતભરની બર્ડ્વોચિંગ-બર્ડ ફોટોએઝિફી અંગે રસ ધરાવતી વ્યક્તિઓ માટે શિબિરનું આયોજન, સતનમધલ, સ્લોથ બેર સેક્યુરી મુકામે કરવા વિચારણા છે. સદર શિબિરમાં મહત્વમાં પદ્ધતિ વિભાગોને સમાવેશ થઈ શકે તેમ છે. આ શિબિરમાં આપે ફક્ત રૂ ૫૦/- ભરવાના છે (ટોકન ચાફી). આપણા આવવા-જવા સિવાયનો બધ્યો ખર્ચ પ્રકૃતિ મિત્ર મંડળ ઉદ્ઘાટન. વિગતવાર કાર્યક્રમ, નામો મધ્યેથી આગળ જાહેર કરવામાં આવશે. વધુ વિગત માટે મંત્રી શ્રી નરેન્દ્ર પંચાલ, 'પ્રકૃતિ મિત્રમંડળ', પ્રકૃતિ ભવન, અમૃતલાદી સોસાયટી પાસે, સેશન રોડ, દાહોદ-૩૮૮૧૫૧, ઝેણાં નં. અધ્યયદેસાઈ ૨૦૭૦૧, ૪૨૮૮૪૮ : નરેન્દ્ર પંચાલ ૪૭૧૪૩

## આકર્ષ વોચ



અવલોકન નોંધ

❖ નણસરોવરના ધરળ કિનારે

તારીખ

૧૬-૬-૦૧

૨૦-૬-૦૧

૨૭-૬-૦૧

૪-૮-૦૧

સંખ્યા

૩૮

૨૮

૨

૭

(તા. ૧૬-૬-૦૧ના રોજ રત્ને વરસાદ આવવાથી સરોવરમાં સારું એવું પાણી આવ્યું હતું.)

કાર્ય સમય

પણસરોવર

❖ તા. ૨૨-૫-૨૦૦૧ના રોજ મૂડાવડેખ ગામ (જિ. પંચમહાલ) નજીક એક ખેતરમાં ૪ સારસ જોયાં. તા. ૨૪-૫-૨૦૦૧ના રોજ ગામની સીમમાં, મહી નદીને કંઠે બે સારસ પાણી પીતાં જોયાં.

મધ્યર-ઉદ્ધૂપિ

વિજયનગર (જિ. રા. કા.)

❖ તા. ૨૩-૫-૨૦૦૧થી ૩૧-૫-૨૦૦૧ સુધી 'ગીર ફાઉન્ડેશન', ગાંધીનગર દ્વારા સારસ પદ્ધીની ગણતરી હાથ ધરાઈ હતી તેમાં અમારા મુખીનાં નાયક ડેમ પાસે ઉ સારસ, હળવદના બ્રાહ્મણી ડેમ પાસે ૮ સારસ તથા જકશી જોડાણામાં દ સારસ જોવા મળ્યાં.

❖ સૌરાભ્રના પ્રથમ વારસાદ અમારા જિલ્લાનાં જળાશયો ભરી દેતાં સારસના પ્રજનનમાં ખાસ વિક્ષેપ નથી આવે એમ લાગે છે. માલાકા તલાવડીમાં સારસની જોડ પાણી આવી ગઈ છે. થાનગઢ પાસે વાંકાનેરના રસ્તે આવેલી તલાવડીમાં પણ સારસની જોડ આવી ગઈ છે.

કિલોરચંડ રાવળ

કુના બસ સ્ટેન્ડ પાસે, મુણી રૂ.૩૫૧૦

❖ તા. ૨-૬-૨૦૦૧ના રોજ હું અમદાવાદથી નીકળી બેણ્ણપ જઈ રહ્યો હતો. વિરમગામ 'ભાયપાસ' પર 'રેલવે કોર્સિંગ' પસાર કરી માંડલ તરફ અમારી સુમો આગળ વધી ત્યારે, ખેતરમાં એક ખૂણામાં જ્યાં વરસાદનું થોડું પાણી ભરાવાથી ખાબોચિયું બની ગયું હતું ત્યાં, સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ સારસની એક જોડી પાણી પીવા માટે ઉત્તરતી જોઈ. ખાબોચિયામાં બને પક્ષીઓ પાણી પીવા લાગ્યાં. ત્યાર બાદ, બે

દિવસમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા કે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં જ્યાં હું કર્યો ત્યાં એક પડી સારસ જોવા મળ્યું નથી.

પી. એસ. ટક્કર

૨૪, નું નંદનવન સોસાયટી, 'દિસ્ટ્રીકશન', અમદાવાદ-૩૦૦૦૧૫

❖ અમદાવાદમાં, ગાંધીનગર સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, 'કશ્વર્વિતી કલબ'ની પાછળના ખેતરમાં ૨૮ મે, ૨૦૦૧ના રોજ સારસની એક જોડી મને તથા મારા કુંભીજનોને જોવા મળી હતી.

મદીપ ઘેડાલ

૩-૧-૨૧, વિકમનગર, દિસ્ટ્રીક્શનલોની, અમલી-બોપલ રોડ, અમદાવાદ-૪૮.

❖ સુરેન્દ્રનગરથી મેમકા જતા રસ્તામાં સારસની જોડી જોઈ. તે પાણીના નાણા પાસે હતી. બીજી જોડી ટાંકીવડલી નજીક જોઈ જે ખેતરમાં મુક્ત ફરતી હતી. ત્યાં પણ પાણીનું નાણું હતું. (તારીખ? - સં.)

❖ તા. ૨૭-૮-૦૧ના રોજ અમે મેમકા (જિ. સુરેન્દ્રનગર) ગયા તારે ત્યાંના તળાવમાં એક સારસની જોડી જોઈ.

યોગેજ શાહ

સુરેન્દ્રનગર

❖ તા. ૨૯-૪-૦૧ના રોજ મસ્ટ્ઝુ-૨ જળાશય (મોરબી પાસે) પર બે સારસ જોયા.

ફરી ૨૩-૬-૦૧નાં મુલાકાત લેતાં, જળાશયમાં માટીવાળું નંબુ પાણી આવેલું હતું. સારસ ન હતાં, પરંતુ દોર ચરાવતાં નજીકના રહેવાસીએ કહું કે, "એક મહિના પહેલાં અહીં ૪૦ સારસ હતાં. તેનો ભડકાથી શિકાર પણ થાય છે."

અશોક મશરૂ

રાજકોટ

❖ મારા, સને ૮૮થી ૮૯ સુધીના પ્રવાસો દરમિયાન બરુદ્ય જિલ્લામાં કોઈ પણ વખત સારસ જોવા મળ્યાં નથી. છાલમાં કેષ્ણે.થી જૂન ૨૦૦૧ સુધીમાં રાજીપીપળા મુકામે બદલી થવાથી, નરિયાદથી રાજીપીપળાના અઠવાડિક પ્રવાસો દરમિયાન વડોદરા, નર્મદા અને બરુદ્ય જિલ્લાઓને આવરી લેતા માર્ગમાં કોઈ પણ વખત સારસ જોવાનું બન્યું નથી.

(પચાસેક વરસથી નાવાપુરા, તા. નાંદોદ, જિ. નર્મદા બે ત્રણ વરસે જવાનું થાય છે. આ અધી સદીમાં મને

## શાસક વોચ

પણ તે વિસ્તારમાં કદી સારસ જોવા મળેલ નથી. - લા.)

તા. ૧૦-૧-૦૧ના રોજ વાસણા-મારગિયાથી કનીજ (તા. મહેમદાવાદ) જતાં, સ્વામીપુર નજીક, ડાબી બાજુ ખેતરમાં, ઉદ્ સારસ જોવાનો સુયોગ પ્રાપ્ત થયો. આ અગાઉ ૧૨-૬-૮૬ના રોજ ઘૃણાદરા, તા. ડાસરામાં (NLBW Vol.36 No.4, જુલાઈ/ ઓગષ્ટ, ૧૯૮૬) તેમજ ૨૮-૨-૦૦ના રોજ જાજથી વસો જતાં, ગરમાળા પાટિયાં નજીક ખેતરમાં, રૂજ સારસ ('વિહંગ', વર્ષ ૩, અંક ૬, વર્ષ ૨૦૦૦) જોવાનો અવસર મળ્યો હતો. ડૉ. પારાશર્ય સાથે

ચર્ચા કરતાં જાણવા મળેલ કે, પાણીની અછતના લીધે તથા નજીક મહીજ તળાવ આવેલ હોવાથી વધુ સંખ્યામાં ભેગાથયા હશે.

❖ ૧૮-૧૨-૦૦, માતરથી લીબાસી ૨

જતાં, ગામ બહાર

❖ ૧૧-૨-૦૧, રાસથી બોરસદ આવતાં ૨

રાવપુરા પહેલાં

❖ ૧૫-૨-૦૧ ડકોરથી ઢાસરા જતાં ૨

ડૉ. એસ. સી. વિશેષ  
નાયાર

## ગીધ પર જાપતો

### અવલોકન નોંધ



\* હું અને મારા વિદ્યાર્થીઓ, સપના સુરેન્દ્રનું અને વિરેન્દ્રસિંહ જાલા તા. ૧૫-૮-૨૦૦૧ના રોજ બપોરે ૨.૩૦ વાગ્યે છોટાઉદેપુર જતાં હતાં તાંયાં, રસ્તામાં અમે ઓરસંગ નદી પાસે આકાશમાં ૬૦ જેટલાં સકેદપીઠ ગીધ (Whitebacked Vulture) ઉડતાં જોયાં. આ પહેલાં અમે લગભગ એક મહિના અગાઉ બોડેલીનાં આકાશમાં આટલાં જ ગીધ ઉડતાં જોયા હતાં. એટલે કે, આ વિસ્તારમાં આ ટોળું હ્યાત છે. હવે તેની રાતવાસાની જગ્યા (roosting site) ની શોધ બાકી રહે છે. જો તે મળી જાય તો તેનો સતત અભ્યાસ કરી શકાય.

ડૉ. ગીતા પડતે

ગ્રાપામેન્ટ એક મુશ્કેલોજી, ફેફલી અંક સાયંસ, એમ. એસ. કું-નીવલેરી એક બરોડા, વરેદરા રેઝિન્યુનિવર્સિટી

\* તા. ૭-૮-૨૦૦૧ના રોજ વિરમગામ જતાં હાસપુર બસ સ્ટોપ, પાસે ઉત્ત ગીધ આકાશમાં ઉડતાં જોયાં. એ જ દિવસે સાંજે, નળસરોવર પાસેના વેકરિયા ગામના પાદરે એક મરેલા ઢોર ઉપર ઉદ્ ગીધ બેઠેલાં જોયા.

કાસમ સમા  
વેકરિયા, નવસરોવર



\* ગીધ (Whitebacked Vulture) તાપી ડિનારે, મરેલાં ઢોર ઉપર નિયમિત જોવા મળતાં, પણ છેલ્લાં દસોક વર્ષથી એટલાં નિયમિત જોવા મળતાં નથી. મહિનામાં બે-ચાર વખત એવું બને છે કે, વીસ - પચીસની સંખ્યામાં આવી જાય, છતાંય નિયમિતતા વિશે કશું કહેવાય નહીં. એક બાબત નિશ્ચિત છે કે, તેની સંખ્યા ખૂબ જ ધરી ગઈ છે.

### અનિબ ભક્ત

એ-૩, લાઇટ પાર્ક, નવુંગડેલેજ પાદળ, જોગાણાનગર, રાદેર રેડ, સુરત-૮

\* તા. ૨૮-૭-૨૦૦૧ના રોજ નળિયા (કચ્છ) પાસે એક સકેદપીઠ ગીધ (Whitebacked Vulture) જોયું.

### શાન્તિલાલ વર્ણ

જૂના વાસ, મંદિરવાળો ખાંચો, માયાપર, જુઝ-૩૭૦૦૨૦

\* તા. ૬-૩-૨૦૦૧થી તા. ૧૧-૩-૨૦૦૧ સુધી ગીરમાં બુસાળા નેસ, અમરતવેલ ગીર વગેરે સ્થળોએ મુલાકાત લેવાનું થયું. બંને સ્થળો, ગીર - પ્રૂવમાં ખાવાની પાસે આવેલાં છે. તે દિવસોમાં સિંહે, અમરતવેલ પાસે ગાયનું મારણ કરેલું, પરંતુ તાં અમને એક પણ ગીધ જોવા મળ્યું નાઈ.

\* તા. ૨૪, ૨૫-૩-૨૦૦૧ના રોજ અમદાવાદ જિલ્લાના ટેનોજ તાલુકાના ગામ રામપુરા-લંકોડાથી ભગાપુરા જતા જગ્યાં એક મરેલાં ઢોરનો ઢોરવાડો હતો. ત્યાં ૨૫-૩૦ ગીધને ખાતાં જોયાં.

### કિશોરચંદ્ર રાવળ

જૂના વાસ સ્ટેન્ડ પાસે, મુખી રેઝિન્યુનિવર્સિટી

## ગુજરાત પર જાપતો

\* તા. ૧૫-૭-૨૦૦૧ના રોજ સવારે ૧૧-૩૦ વાગ્યે મોરબી, પાડાપુલ ઉપર બે ગીધ જોયા. રાજકોટમાં ગીધ દેખાતાં બંધ થયા છે, તેથી અહીં ગીધ જોતાં ખૂબ આનંદ થયો.

**નવનીત વાગડિયા**  
સોની બજાર, માંડવા ચોક, ખર્ણી વાડ, રાજકોટ-૩૬૦૦૧

\* તા. ૧૬-૧૨-૨૦૦૦ના રોજ પ્રતાપસેવક સાથે પદ્ધીનિરીક્ષણ માટે ગયા ત્યારે, ઘણેટી (તા. અંજાર)ની સીમમાં ૩૦+ ગીધ જોયા, તેમાં સફેદપીઠ ગીધ (Whitebacked Vulture), એરા (Egyptian Vulture), પદ્ધાડી ગીધ (Griffon Vulture) તથા ગીરનારી ગીધ (Longbilled Vulture) હતાં. (ક્રાં, કેલાં? - સ.)

તા. ૩૧-૧૨-૨૦૦૦ના રોજ જખ્યો સીમમાં (તા. અબદાસા) ૮૦ સફેદપીઠ ગીધ ઉડતાં જોયાં.

**અધિકારી પોસ્ટ**  
**લુઝ**

\* તા. ૨૬-૪-૦૧ના મર્યાદ-૨ જળાશય પર આકાશમાં ૫ સફેદપીઠ ગીધ ઉડતાં હતાં. તા. ૨૩-૬-૦૧ મોરબી પાડાપુલ પાસે બગીચામાંથી ૧૧ સફેદપીઠ ગીધ આકાશમાં વિહરતાં જોયા.

**અશોક મશ્રે**  
રાજકોટ

## પત્ર-કોટુ



Dear Bakulbhai,

As always, I have enjoyed reading through the monsoon volume of VIHANG. There is so much information and what is heartening is that people in rural communities are reading and sending in responses.

Chhotubhai Suthar indeed has got his Whitebreasted Waterhen mixed up with the Painted Snipe and this should provide caution to hasty identifications. Recently, going through two of my own earlier write ups, I was shocked to find wrong identifications that have, unhappily, gone into print. My records were not questioned

and even now I feel very unhappy when I think of those two claims. Both were made when I was a college-student. Fortunately, both wrong identifications are not from Gujarat. With so many more birdwatchers out in the field great care must be taken before making claims. Even a seasoned birdwatcher can make a misidentification.

Pranav Trivedi's observations (page 6) on the birds of Bakore in Panchmahals is revealing. Pittas and Tickel's Blue Flycatchers have become the dominating species where a few years back were Crested Buntings and Painted Partridges.



The climax of achievement would be having a Black Woodpecker nesting there !

Uday Vora's note on the Blue tailed Bee-eater (page 7) needs comment. Gujarat has both Bluetailed and Bluecheeked Bee-eaters nesting. It would be interesting to find the interface between the two species, which were for long considered to be subspecies.

We must make a very serious effort to locate the colonial nesting colonies of Glossy Ibis in the State. There are such large flocks around in full breeding plumage. They must be breeding.

Krishnaba Gohil's note on the Large Green Parakeet in Bhavnagar (page 7) calls for comment. Parakeets are great fliers and of late their numbers, as those of Blossomheaded Parakeets, have increased considerably around Ahmedabad. It is worth noting that Bhavnagar is not very far from mainland Gujarat across the Gulf of Khambhat and these hole-nesting birds must be scattering across wider country in search of suitable, large trees. Of course, the birds seen could be escapees.

Peafowls have taken to roosting on electrical pylons (Jitendrasinh Sodha and Mahesh Vaishnav, page 9) because of loss of large trees.

In conclusion, once again I must urge you to include the date of each communication other than of long articles.

Yours,

**Lavkumar Khachar**  
Hingolgadh, 21st August, 2001

#### યબૂતરાની વિવિધતા અને વિશિષ્ટતા

આમ તો સમાજકલ્યાણની સરકારપ્રેરિત પ્રવૃત્તિઓને કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ઘણાં શહેરોમાં, કૃબામાં ફરવાનું થયેલું છે. ગત ઉનાળે પાણીની તંગીને કારણે અમે રાજકોટ છોડી ખંભાતના દરિયાનિરારે બે મહિના રહ્યાં. તે સમય દરમિયાન નોંધું કે વધારેમાં વધારે કોઈ પણ કૃબા કે શહેરમાં ચબૂતરા હોય તો તે આશાં જિલ્લાના ખંભાતમાં તાં શેરીએ શેરીએ પક્ષીઓને ચણ નાખવા વિધવિધ પ્રકારના,

આકારના અને વધુ ભાગે કાણના બનેલા ચબૂતરા છે. અમોઓએ એક ડાન તો ગણ્યા. આમ તો ખંભાત એ પૂરાણું બદર હોઈ, મકાનો પર કાણનું કોતેરકામ બ્યાપક જોવા મળ્યું. લગભગ જૂનાં પદતર મકાનોના જરૂરા, સ્થાન, ચોકઠાં, ટેકા, બધાં લાકડાનાં જ. ચબૂતરા મોટા ભાગે, સખત સાંગી લાકડાના અને સુંદર જોવા આકૃતિ અને કોતેરણીકામ સાથેના. કોઈને 'પીએચ.ડી.' કરવું હોય તો ખંભાતના ચબૂતરા પર થઈ શકે એટલી વિવિધતા, વિશિષ્ટતા ત્યાં રહેલી છે. 'WHO'ને માહિતી પૂરી પાડતી અમેરિકાની એક એજન્સીમાં કામ કરતી, વોશિંગટન ડી.સી. સ્થિત, વાઈલ લાઇફની અભ્યાસી અમારી પુની દર્શના વાસે લગભગ વિશ્વના બાવન દેશોનો પ્રવાસ કર્યો છે. તેણીના કઢેવા મુજબ, પક્ષીઓની સાચવણી, રક્ષણ અને સંબંધ સાથેની આવી ચબૂતરા - સંસ્કૃતિ કોઈ પણ દેશમાં જોવા મળી નથી. ભારતની અને એમાંથી ગુજરાત-સૌરાષ્ટ્રની આ વિશિષ્ટતા છે. આર્થ સંસ્કૃતિનું મહામૂલું પ્રતીક છે.

ધંધુકા અને વલભીપુર, વળા વચ્ચેના ભાલ પ્રદેશમાં તેમજ દસાડા, પાટી વગરે રણકાંઠાના ગ્રામીણ મદેશમાં અમે પક્ષીઓનાં ચણ માટે, ઊંચા, ચોરસ આકારના મોટા, ઓટેલા જોવા છે, જે માથોડા જેટલા ઊંચા અને ફૂતરાં, બિલાડાં કે અન્ય પણ ન ચરી શકે તેવી રચનાવણા, મોટા ભાગે ખળવાડ પાસે હોય છે.

વૈદ્ય વજુલાઈ વાસ  
એમ-૧૪/૧૦૮, સ્વાતંત્ર્ય સેનાનીનગર-૨, અમદાવાદ-૩

+++

#### ‘વિહંગ’નો કયા શબ્દોમાં આભારી બન્નું ?

‘વિહંગ’ નિયમિત મળતું રહેલે છે. એકાંતમાં એને વાંચું છું ને એક અનોખી દુનિયામાં ખોવાઈ જાઉં છું. મળતું થયું, ત્યારથી જ પક્ષીઓ પ્રત્યે બેછદ લગાવ શરૂ થયો છે. આ વરસે મેં ધોલેરા (બંદર) વિસ્તારનાં ભડિયાદ, જાંબુડા, મુંડી, પાંચી, ભાણગઢ, જાંખી વગરે ગામોમાં અંદાજે ૪૦૦૦ વૃક્ષો ગ્રામજનોની સહાયથી ઉછેરવાનું શરૂ કર્યું છે. ગ્રામજનોને પણ પક્ષીઓ માટેની આપણી ફરજનું ભાન કરાવતા પત્રો છિપાવીને આખ્યા છે. ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. ૪-૫ વર્ષમાં આ વૃક્ષો આભે અડવા મથશે અને પક્ષીઓના કલબલાટ થકી નાનકડાં ગામો ધમધમી

પત્ર-કોટુ

ઉઠશે. બસ, આ સમયની પરીક્ષા અત્યારથી જ અકળવી રહી છે. આવા સુંદર અભિયાનમાં મને જોડાવાની અનોખી પ્રેરણા બદલ 'વિહંગ'નો કયા શબ્દોમાં આભારી બનું? નેચર કલબ સુરતે પણ પનરવાનાં વૃક્ષો ઉછેરવા અમોને પ્રોત્સાહિત કર્યા છે.

(૧૦-૮-૨૦૦૧)

અરુણ ત્રિવેદી  
આશીવંદ ફ્લેટ, વાસના, અમદાવાદ

+++

**એ 'વિહંગ'ના સણંગ અંકો ૧૨ તથા ૧૩ ઉપર ટિપ્પણી**

\* 'વિહંગ'નો ગ્રીઝ ૨૦૦૧ અંક સમયસર મળી ગયો છે. સરસ છે. તેમાં કેતન ટાઢુએ કુવાર બેટમાં 'ગ્રેલાઈપોકેલીયસ' જોયાનું વાંચ્યું. અહીં જ ૧૯૬૦ની સાલમાં કંચમાં પ્રથમ વાર આ પક્ષીની નોંધ થયેલી. ત્યારે 'B.N.H.S.' નો 'ક્રેચ' ચાલતો હતો, જેમાં સ્વ. ડૉ. સલીમ અલી પણ હાજર હતા.

\* ડૉ. ભવભૂતિ પારાશર્ય તથા તેમના સાથી મિત્રોની રાજીપીળાના પોપટના વધતા જતા વ્યાપ વિષેની નોંધ વાંચી. પહેલા માંડવી(કંચ)માં પણ આ પક્ષી જોવા મળતા હતા અને ત્યાં પ્રજનન પણ કરતા હતા. મ. કુ. શ્રી હિંમતસિંહજી સાથે થયેલી ચર્ચા મુજબ તે ભાગેહું હોવાં જોઈએ.

(૨૪-૬-૨૦૦૧)

\* આપે 'સંપાદકીય'માં જ્ઞાવેલું છે કે, ટ્યુસિયાએ

સુગરીનો માળો રોકી લીધો છે. મારે ત્યાં પણ ટ્યુસિયા(Whitethroated Munia)ની જોડી સુગરીના જૂના લટકાવેલા માળાની મુલાકાત લે છે, પરંતુ માળો કર્યો નથી. ક્યારેક શક્કરખોરો (Purple Sunbird) પણ આ માળાની મુલાકાત લઈ જાય છે.

\* મારી ૨૩-૫-૨૦૦૦ની નોંધમાં દુદમાતા તેમને બદલે રૂક્ષજીમાતા તેમ ભૂલથી લખાયું હોય તેમ લાગે છે.

\* શ્રી લવકુમાર સાહેબે તેમની નોંધમાં મોટા રાજાલાલ (Scarlet Minivet)ને બદલે લાંબીપંદુ રાજાલાલ (Longtailed Minivet) હોવાની શક્યતા અંગે વાત કરી છે. આ અંગે જાણાવવાનું કે, આ પક્ષીની ઓળખ મ.કુ.શ્રી હિંમતસિંહજીએ કરી હતી અને એ નોંધ 'B.N.H.S.'ના 'જનલ'માં પ્રસિદ્ધ થઈ હતી. કંચમાં ક્યારેક આવાં વીરલ પક્ષીઓ આવી જાય છે, જેમ કે, બપૈયો (Hawk Cuckoo) અને શામશિર કરણા (Blackheaded Cuckoo-Shrike) ની નોંધ પણ કંચમાં થઈ છે.

\* શ્રી જિતેન્દ્રભાઈ સોઢા તથા શ્રી મહેશભાઈ વેણ્ણવની નિરીક્ષણ નોંધમાં મોર ઈલેક્ટ્રીક વાયર પર રાતવાસો કરે છે તે જાણું. મે ૨૮-૭-૦૧ના રોજ ભવાનીપર-બીજા વચ્ચે (તા. અબડાસા) આવા પ થી દ વાંબલા પર વહેલી સવારે મોર જોયાં હતાં. તે અહીં રાતવાસો કરતાં હોય તેમ લાગ્યું.

(તા. ૧૦-૮-૨૦૦૧)

શાંતિવાલ વરુ

જૂના વાસ, મંદિરવાળો ખાંચો, માયાપર, સુધી-૩૭૦૦૨૦

+++

**Birdwatcher's Directory**

Surname \_\_\_\_\_ Name \_\_\_\_\_ Father's Name \_\_\_\_\_

Address : \_\_\_\_\_

Tel. No. : Res : \_\_\_\_\_ Office : \_\_\_\_\_ Mobile : \_\_\_\_\_

Fax : \_\_\_\_\_ E-Mail : \_\_\_\_\_ Addl.No. \_\_\_\_\_

Interests : Bird Watching  Nature trail  Conservation  Bird Photography

ફોર્મ ભરીને મોકલવાનું સરનામું :

નેચર કલબ, C/O સેહલ પટેલ, ૮૧, સર્જન સોસાયટી, અઠવા લાઈન્સ, સુરત-૩૮૫૦૦૭

**કુચ્છમાંથી 'સ્ટોલિક્ઝકસ બુશ ચેટ'** લુપ્ત થઈછે  
આજે 'વિહંગ'નો સંખ્યા અંક : ૮, ગ્રીભ, ૨૦૦૦  
વાંચતા, શાંતિવાલ વરુની કુચ્છમાં પક્ષીનિરીક્ષણ નોંધ(પાના  
નં. ૧૨)માં Stoliczka's Bush Chatનો ઉલ્લેખ વાંચી  
આશર્ય થયું કરારા કે, આ પક્ષી હવે કુચ્છમાં જોવા મળતું  
નથી. શાંતિભાઈને આ બાબત પૂછતાં તેમણે જણાયું કે, ખરી  
રીતે 'Desert Chat' જોયાં હતાં, જેનું નામ ગુજરાતીમાં  
તેમણે 'રણ પિઢો' નોંધમાં દરખિલ. તેમણે ખુલાસો મોકલ્યો  
હતો, જે વખતે પ્રસિદ્ધ ન થયો હોય.

Stoliczka's Bush Chatની શોધ પહેલવહેલી  
કુચ્છમાં જ થયેલી. Dr. Ferdinand એક ભૂસ્તરશાસ્ત્રી હતા  
જેમણે આજથી ૧૦૦ વર્ષથી વધારે સમય અગાઉ ઓગણીસમી  
સદીમાં કુચ્છમાં પ્રાણીઓ અને પક્ષીઓનો અભ્યાસ કરેલ.  
આનો અહેવાલ બંગાળમાંથી તે સમયે પ્રસિદ્ધ થતાં 'Stray  
Feathers' માં આપેલ. ઉપરોક્ત પિંડાની શોધ તેમને ફાળે  
જાય છે. તેમણે આ પક્ષીના બે નમૂના કુચ્છમાં ભુજ પાસે અને  
રાપર તાલુકામાંથી મેળવ્યા અને તેમનું વિસ્તૃત વર્ણન કરેલ.  
ત્યાર બાદ, આ પક્ષી કોઈ કારણોસર કુચ્છમાંથી લુપ્ત થયું.  
ઉત્તર-ગ્રાન્થમાં પડી તે અસ્તિત્વ ધરાવતું અને ત્યાંથી પડી  
અદશ્ય થઈ ગયું છે. હવે ફક્ત તે રાજસ્થાનમાં જોવામાં આવે  
છે. હાલ મેં ક્યાંક વાંચ્યું છે અથવા સાંભળ્યું છે કે, ભાવનગર  
પાસે વેળાવદરના કાળિયાર રક્ષિત વિભાગમાં કોઈક આ  
પક્ષીની નોંધ કરી છે.

હાવના સમયમાં અમુક સ્થાનિક ઉપરાત યાયાવર  
પક્ષીઓની સંખ્યા ઘણી જ ઘટવા પામી છે. આ પૈકી એક  
મળતાવડી ટિટોડી (Sociable Lapwing or Plover) છે.  
કુચ્છમાં છેલ્લી વાર આ પક્ષીને મેં ઓગાષ ૧૯૪૭માં જોયા  
હતાં. મારા શિક્ષક પી.એચ.સ્પાક્સરના પત્નીએ પણ એ જ  
અરસામાં લગભગ એ જ જગ્યાએ (માંડવી બંદરની પદ્ધતિમાં)  
એકથી વધારે વધત આ પક્ષી નોંધાયાં હતાં. ત્યાર બાદ, મેં  
અથવા બીજા પક્ષીનિરીક્ષકોએ જોયાં નથી. આ પક્ષી સૌરાષ્ટ્ર કે  
ગુજરાતના બીજા કોઈ સ્થળે જોવામાં આવે તો તેની નોંધ  
'વિહંગ'માં પ્રસિદ્ધ કરવા માટે મોકલવી જરૂરી છે. 'B.N.H.S.'ને  
પણ જાણ કરવી જોઈએ. આ પક્ષી બિનખેડાયલાં ખેતરો અને  
ખુલ્લી પડતર જમીન પર સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.

મ. કુ. લિમતસિંહજ  
જ્યુનિવેશિયાન્ડ, લુઝ-૩૭૦૦૦૧

+++

**કુચ્છમાંથી 'Albinism' અને 'Colour mutation'**

ગ્રીભ ૨૦૦૦ના 'વિહંગ'ની નિરીક્ષણ નોંધમાં  
ડૉ. આર. બી. બલર અને ડૉ. રેખા બલરે જોયેલો આંશિક,  
વિવર્ણ કાળાકોશીનો ઉલ્લેખ છે. બન્ને ડૉક્ટરો વિવર્ણ જીવોની  
લાક્ષણિકતા વિશે જાણતા જ હોય તેમાં સંશેષને સ્થાન નથી,  
પરંતુ નાતપૂર્વક એ જણાવવાની છૂટ લઉંછું કે, આવાં વિશિષ્ટ  
પક્ષીઓનાં વર્ણન કરવામાં નાનામાં નાની વિગતો રહી જવી  
ન જોઈએ. ખરી રીતે, આ વસ્તુ, સામાન્ય પક્ષીઓની નોંધોમાં



પણ જરૂરી છે. માણીઓમાં કોઈ વાર albinism જોવા મળે છે. તેઓની લાક્ષણિકતામાં, લાલ યા દેરી ગુલાબી રંગની આંખો મુખ્ય છે. એ કણાકોશીની આંખ અને ચાંચના રંગ પરથી જ તેને આંશિક વિવર્જન કર્યો હશે.

'Albinism'ની સાથે પકીઓમાં 'Colour mutation'ના દાખલા પણ જોવા મળે છે. મેં સફેદ કાગડો અને સફેદ સાથે સામાન્ય રંગમિશ્રિત કાબર જોઈ છે. આ ઉપરાંત સફેદ કાળીપૂંઘ ગડેરો (Blacktailed Godwit) અને ટીલિયો (Reeve) પણ જોવાં છે. એ બધાં પકીઓની આંખ લાલ ન હતી. આવાં પકીઓના રંગમાં ફેરફાર, રંગસૂત્રની ખામીઓને લીધે થતાં હોય છે. એટલા માટે તેમને 'mutant' તરીકે સંભોધવામાં આવે છે. આ વિવેચન 'વિહંગ'ના બહોળા વાચક સમુદ્દરની જાણકારી ખાતર કર્યું છે.

મ. કૃ. ડિમતસિંહશ

જ્યુલિલિ પ્રાઉન્ડ, મુજ-૩૭૦૦૦૧

+++

## કુઝનો શિકાર અટકાવીએ

ઉત્તર-પશ્ચિમના દેશોમાંથી હજારો ડિલોમીટરનો પ્રવાસ કરીને ભારત આવતાં કુજ (કુજ અને કરકરા બન્ને, Common and Demoiselle Crane) પકીઓને શિયાળો ગાળવા માટે સૌરાષ્ટ્ર - ગુજરાતના વિસ્તારો ખૂબ જ પસંદ પડે છે. મોટા ભાગે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નદીકાંઠના વિસ્તારો અને પાણીની ઉપલબ્ધિવાળા તેમ અને તળાવ વિસ્તારમાં આ પકીઓ વિલાર કરે છે. આ પકીઓ અનેક વર્ષોથી નિયમિત રીતે આપણા મલકમાં આવતાં હોઈ, આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલ છે, તેમજ આપણા લોકગીત અને કહેવતોમાં પણ તેમને ખૂબ જ અદ્દકું સ્થાન મળેલ છે. આપણા આ મોંધેરાં મહેમાન કે જેનો વન્યજીવ સંરક્ષણ અધિનિયમના પરિશિષ્ટમાં સમાવેશ થતો હોવાથી તેનો શિકાર કરવો તે 'કોનિઝેલ્બ' ગુન્હો બને છે, તેનું આપણે ત્યાં જતન કરવું અને તેનો શિકાર ન થાય તે જોવું, તે આપણાં સૌની ફરજ છે. આ વર્ષે ગુજરાત - સૌરાષ્ટ્રમાં વરસાદ ખૂબ જ થયેલ છે અને મગજણીનું મોટા પાયે વાવેતર થયેલ છે, ત્યારે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ આ પકીઓનો શિકાર કરવા શિકારીઓ ઉત્સુક હોય તે સ્વાભાવિક છે. માટે કુજ પકીઓનું અતે આગમન થાય તે પહેલાં જ તેનો શિકાર થતો અટકાવવા માટે

આગોતું આયોજન કરી અસરકારક પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તે માટે આવા વિસ્તારના લોકોને પણ જાગૃત કરી અને તેમનો સહકાર મેળવી, આવા શિકારીઓની માદિતી, તુરંત સંબંધિત અધિકારીને મળી રહે તે માટે લોકોને ઉત્સાહિત કરવા ખૂબ જ જરૂરી છે. વિકલ્પે, આવી બાબત આપના ધ્યાન ઉપર આવે તો શ્રી પ્રેન્સીપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ને જાણ કરવા વિનંતી છે.

આશા છે કે, આ બાબતે આપ અગાઉથી આયોજન કરીને પકીઓનો શિકાર થતો અટકાવશો.

પ્રકૃતિજીતન પરિવાર

ભાષ્યક

+++

## અને 'વિહંગ'ને કંઈક કહેવાનું મન થયું...

આજે સ્વાતંત્ર્યદિન છે (૧૫-૮-૨૦૦૧). માંડવી (જિ. સુરત)માં આજે સવારે ભારે વર્ષા થઈ. અત્યારે પણ જોરદાર વર્ષા ચાલુ છે. ૮ થી ૧૦ ઈંચ વરસાદ પડ્યો લાગે છે. સુંદર વાતાવરણ છે. અચાનક ધોડા પર પેલો 'વિહંગ' પર નજર પડી અને 'વિહંગ'ને કંઈક કહેવાનું મન થયું. 'વિહંગે' તમામ પકીવિદો, પકીનિરીક્ષકો પકીપ્રેમીઓનાં હદ્યમાં કાયમનું સ્થાન બનાવી લીધું છે તથા સૌની અમી નજર આપની તરફ છે.

આપે જે વિચારને આકારડ્યું આપ્યું તે હું લાંબા અરસાથી વિચાર કરતો જ રહ્યો કે, સૌ પકીપ્રેમી મિત્રોની જાણકારી મળે, તેઓ સમયાંતરે મળ્યા કરે, તેઓ પકીનિરીક્ષણનાં સ્થળોની જાણકારી પરસ્પર આપે અને તે રીતે મદદરૂપ થાય.

આ સિવાય 'વિહંગ'માં પકીનિરીક્ષણ માટેનાં પોગ્ય સ્થળો, જળશાયો, જંગલ વિસ્તારો, ખાડી, બંધ વગેરે નકશા દ્વારા દર્શાવાય, જે-તે સ્થળે જવાની, રહેવાની વ્યવસ્થા અંગે માદિતી અપાય, ત્યાંની જાણકાર વ્યક્તિઓ (Resource Person) અંગે વીગતો જાણાવાય, તો તે ખૂબ ઉપયોગી થાય.

શુંગરસિંહ સોલેન્ડી

આર. એફ. ઓ., માંડવી, ઊરા રેજ, જિ. સુરત-૩૮૪૧૬૦

+++

**ક્લો શ્રી લવકુમાર સાહેબ પાસેથી હજુ ગુજરાતે  
શીખવાનું છે.**

ગ્રીઝ ૨૦૦૧નો 'વિહંગ' નો અંક મણ્યો, વાચીને આનંદ થયો. ખાસ તો આદરશીય શ્રી લવકુમારસાહેબે તેમનો સિસેરમો જન્મટિન કષ્ટના અખાતમાં, મણ્યવામાં ઉજવ્યો અને તે પણ એકાંતમાં, કુદરતના ખોળે એકલા બેસીને માણયો, તે જાણીને તેમને જાણે નજરે જોતા હોઈએ તેવી લાગડી થઈ. અમે ભીલવસી ગયા ત્યાર પછી સાહેબને મણ્યા નથી, પણ તેમને અમે જરા પણ ભૂલ્યા નથી. સાહેબને તેમના જન્મટિનની (better late than never!) શુભેચ્છા ! તેઓ ખૂબ લાંબું આયુષ્ય ભોગવે અને ભારતને તેમના વિશાળ જ્ઞાનનો લાભ મળતો રહે તેવી ઈશ્વરને ગ્રાર્થના.

શ્રી લવકુમાર સાહેબની હિંગોળગઢની શરૂઆતની શિબિરમાં અમે ત્રણે બહેનો ગયેલાં. તે વખતે શ્રી સાલિમ અલી ત્યાં આવ્યાં હતાં. એક પદ્ધીનું નિરીક્ષણ કરતાં શ્રી સાલિમ અલીએ "It is probably a Whitebellied Minivet", એમ ઓળખાણ આપી હતી, ત્યારે શ્રી લવકુમાર સાહેબે બધા શિબિરાર્થીઓને આ વાત ખાસ ભારપૂરક જાણવેલી કે, પદ્ધીદર્શનમાં ઉતાવળે નિર્ણય કરી ન બાંધવ્યો. હમેશાં "કદાચ" ("Probably") શબ્દ યાદ રાખવો, કારણ કે, સમયે સમયે પદ્ધીનાં રૂપ, રંગ, અવાજ જુદાં જુદાં હોય છે.

શ્રી લવકુમાર સાહેબ પાસેથી હજુ ગુજરાતે જુદા જુદા ખડકો, ધાસના પ્રકાર, વૃક્ષો જેવા વિવિધ વિષયો ઉપર શીખવાનું છે. ગીર અભ્યારણ્યમાં 'બાજરીયા પ્રકરણ' સમયે ગીર બચાવવા માટે સાહેબ, જાણ થતાં જ સ્થળ પર ઉપવાસ ઉપર ઉત્તરેલા. આજે આવી હિંમત સાહેબ પાસેથી કેળવવાની

છે. જંગલમાં ચાલતાં ચાલતાં જ રસ્તે આવતાં વૃક્ષો, કાંચીંડા પક્ષીઓ તથા અન્ય જીવો વિશે સહજપણે માહિતી આપતા અને આ સુંદર વનોને સાચવવાની ટકોર કરતા શ્રી લવકુમાર સાહેબ સાથે વનભૂમાણ અમે માણ્યું છે. તેઓ હજુ પણ આવું જ્ઞાન અને આવો આનંદ અન્યને પણ આપે છે અને ભવિષ્યમાં આપ્યા કરશે તેવી આશા સાથે.

તર, સોલાણ  
ભીલવસી

\*\*\*

**ક્લો 'રીંગ રીકવરી'**

શ્રી શાંતિલાલ વરુની નોંધ, ઋતુપ્રવાસી પક્ષીઓની 'રીંગ રીકવરી' ('વિહંગ', સંંગ અંક ૧૩, પા. ૧૬) ના સંદર્ભમાં થોડી પૂરક વિગતો મોકલું છું.

૧. તા. ૩-૨-૧૯૮૮ના રોજ એક મોટી વાબગલી (Caspian Tern, *Hydropogn caspia*) ખેડા જલવાના પરીએજ તળાવ ઉપરથી મળી હતી. તેને કાબિસ્તાનના તેન્જીઝ સરોવર (Lake Tengiz) ઉપર, તે માળામાં બચ્યું હતું ત્યારે, તા. ૮-૮-૧૯૮૭ના રોજ 'રીંગ' કરવામાં આવી હતી. 'રીંગ' કર્યા પછીના ૧૪૮ દિવસમાં તેણે આ અંતર કાણ્યું હતું.

૨. ગુજરાતમાં પ્રાપ્ત થયેલ રીંગવાળા પક્ષીઓની જે વિગતો આપી છે તેમાં દશવિલ 'સીગલ' (અનું. ૨) એ મોટો ખોમડો (Great Blackheaded Gull, *Larus ichthyaetus*) હતો. રશીયાના Astrakhan Provinceમાંથી તા. ૨૫-૫-૧૯૮૧ના રોજ તેને 'રીંગ' પહેરાવવામાં આવી

સાલાર સરીકાર

૧૦૦૦-૦૦	બિન્ડુ કાપડિયા, મુંબઈ	૨૫૦-૦૦	કલેશ રાવળ, જેતપુર	૧૦૦-૦૦	નરેન્દ્ર પંચાલ, દાઢોદ
૫૦૧-૦૦	જયંતભાઈ બોજીવાલા, માંડવી	૨૫૦-૦૦	અણ્ય દેસાઈ, દાઢો	૧૦૦-૦૦	શ્રી વિશ્વકર્મા પર્મિચાર સમિતિ,
૫૦૦-૦૦	ઠુંગરસિંહ સોલંકી, માંડવી (સુરત)	૨૦૦-૦૦	કમલ મહેતા, અમદાવાદ	૧૦૦-૦૦	કે. એ. દેસાઈ, ગાંધીનગર
૫૦૦-૦૦	હેમત સુથાર, ગાંધીનગર	૨૦૦-૦૦	ડૉ. રાજીવ ઠાકર, અમદાવાદ	૧૦૦-૦૦	એ. જે. અધીન, ગાંધીનગર
૫૦૦-૦૦	૫વલ દેસાઈ, વડોદરા	૧૭૬-૦૦	જયપાલસિંહ જ્ઞેઅ, જ્ઞાનગર	૧૦૦-૦૦	સી. જ. પિલ્લાઈ, ગાંધીનગર
૫૦૦-૦૦	ડૉ. પીપૂપ માટલિયા, જ્ઞાનગર	૧૦૧-૦૦	ડૉ. એમ. ટી. દેસાઈ, આંણંદ	૫૧-૦૦	રાજેશ ત્રિવેદી, ભાવનગર
૫૦૦-૦૦	કે. એસ. ચોકર, અમદાવાદ	૧૦૧-૦૦	સુરેણ મંકડિયા, ધોરાજ	૫૦-૦૦	વિરેન્દ્રસિંહ જાલા, વડોદરા
૩૦૦-૦૦	નિદિત્તાબેન મુનિ, ભાવનગર	૧૦૦-૦૦	કિશોર શાહ, ભુજ	૫૦-૦૦	શરીકાન્ત બાબુભાઈ, મુંબઈ
૨૫૦-૦૦	દુર્વલભાઈ રાહેદ, મોરબી	૧૦૦-૦૦	યોગેન્દ્ર શાહ, સુરેણ્નગર	૫૦-૦૦	શાંતિલાલ વરુન, ભુજ

હતી. જે તા. ૨૮-૩-૧૯૮૮ રના રોજ પોરબંદર ખાતેથી મળી હતી. આમ ૩૦૭ દિવસના ગાળામાં તેણે ઉરુફ ડિ.મી.નું અંતર કાઢ્યું હતું.

ભવભૂતિ પારાશય'

ગુજરાત એન્ડ ક્રિક્ટર કુનીવર્સિટી, આશાં-૩૮૮ ૧૧૦

\*\*\*

## ૬) “સૌરાષ્ટ્રમાં રાજહંસ” વિશે

ગ્રીઝ-૨૦૦૧ અંકમાં ડિશોરચંદ્ર રાવલે નાયકા ડેમમાં ૮ રાજહંસ જોયા તે નોંધ આવી છે. તે અંગે જણાવું તો,

રાજહંસ એ સુરેન્નગર જિલ્લાના નાયકા અને થોરીયાળી બંધોના નિયમિત શિયાળું મુલાકાતી છે. તા. ૧૧-૧-૮૮ના રોજ સ્વ.શ્રી જસદાસ દરબાર સાહેબે, ડૉ. તેજ મુંડકુર સાથે નાયકા પર રૂત રાજહંસ અને એક પથબ્રાણ ‘સ્નો ગુઝ’ જોયેલ. ૧૯૮૪ની એશિયાઈ પક્ષી ગણતરીમાં થોરીયાળી બંધ પર ૩૦ રાજહંસ નોંધેલ. જાન્યુઆરીમાં આ જણાશયોમાં નિરીક્ષણ થઈ શકે તો રાજહંસની નિયમિતતાનો વધુ ખ્યાલ આવે.

અશોક મશ્રે

ચાંકડે

\*\*\*

## મ.કુ.હિંમતકિંસિહલાલી કલમે

હંજના પ્રજનનની ચોક્કસ ઋતુ છે?

સામાન્ય માન્યતા એવી છે કે, કંચના મોટાં રણમાં હજ, જુલાઈ અને સપેન્ટેમ્બર વચ્ચે બચ્ચાં ઉછેરે છે. ઓગસ્ટિસમી સદીમાં, આ પક્ષીના પ્રજનનની શોષ થઈ ત્યારથી આજ સુધી એ માન્યતા મહદું અંશે સાચી હતી. દાલ અમુક ફેરફાર થવા પામા છે, તેથી પહેલાની પરિસ્થિતિ રહી નથી. વળી, હજનું નિયમિત રીતે રણના મૂળ સ્થળમાં પ્રજનન થતું નથી. આ હકીકિત નીચે આપેલ વિગતોથી સ્પષ્ટ થશે.

હંજના પ્રજનનની કોઈ ચોક્કસ ઋતુ નથી કારણ કે, તેનો આધાર વરસાદના આગમન, મોટાં રણમાં પાણીનો ભરાવો અને ત્યાં રહેલી ખોરાકની ઉપલબ્ધી પર રહેતો આવ્યો છે. જે સાલમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને દુષ્કાળ પડે, ત્યારે ત્યાં આ પક્ષીઓ બચ્ચાં ઉછેરે કરતાં નથી. આવાં વર્ષોમાં તે બીજા કોઈ પાડોશના દેશમાં પ્રજનન કરે છે કે કેમ, તે આજપર્યત સંશોધનનો વિષય રહ્યો છે. આ માટે જ્યારે હજ મોટી સંખ્યામાં રણની અંદર બચ્ચાં ઉછેરે ત્યારે, શક્ય તેટલાં બચ્ચાઓને, તેઓ ઊડવા માર્ગે તે પહેલાં પગમાં કરીએ પહેરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આટલા માટે વૈજ્ઞાનિકો સિવાય અન્યોને હંજની રણની વરસાદની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ફક્ત કૂતુહલવશ આ પક્ષીના પ્રજનન કાર્યમાં ખલેલ પહોંચાડવી ન જોઈએ. આ બાબતે બીજાઓ કરતાં જંગલ ખાતાની વિશેષ જવાબદારી છે. મૂળ

વિષય પર

આવતાં, જે અતિ ભારે વરસાદ વરસે અને રણમાં પુષ્ણ, પાણીનો ભરાવો થાય તો માળા બનાવવામાં, ઈંડાં મૂકવામાં મોટું પણ થાય. દાખલા તરીકે, ૧૯૪૫ની સાલમાં જ્યારે હંજની વરસાદની ડૉ. સલીમઅલીએ મુલાકાત લીધી ત્યારે, એપ્રિલ માસમાં ત્યાં બચ્ચાં હતાં. તે વર્ષે તેમના અંદાજ મુજબ મોટાં પુષ્ણ વયનાં પક્ષીઓ અને બચ્ચાંસાહિત વીસથી પચીસ લાખ કુલ પક્ષીઓની સંખ્યા હતી, જ્યારે ૧૯૭૪ની સાલમાં જાન્યુઆરી મહિનામાં પ્રજનન ચાલુ હતું. તે વરસે પહેલી જ વાર માળા અને ઈંડાં સાથે નાનાં હજ નોંધવામાં આવેલ.

કંચની ભૂગોળનો અભ્યાસ કરીએ તો, લગભગ વચ્ચેના ભાગમાં કુગરોની હારમાળા આવેલી છે. આ કુગરોમાંથી નદીઓ નીકળે છે. તેમાં અમુક દક્ષિણવાહિની છે, બીજી ઉત્તરવાહિની. દક્ષિણવાહિની નદીઓનાં પાણી સમુદ્રમાં ભળી જાય છે, જ્યારે ઉત્તરવાહિની રણમાં ઠવવાય છે. બીજી તરફ, રાજ્યસ્થાનમાંથી લૂણી નદી રણમાં ભળે છે. પૂર્વ તરફ, બનાસનું પાણી મોટા રણમાં પ્રવેશે છે. જ્યારે જોરદાર પવન ફૂકાય ત્યારે, આ ખારું પાણી રણની અંદર આગળ પડેલાય છે. આમ ખારાં અને મીઠાં પાણીની ભેણસેળ થાય છે, જેમાં હજ જેવાં પક્ષીઓ માટે વિપુલ પ્રમાણમાં ખોરાક

મળે છે. અગાઉસામાન્ય રીતે સારો વરસાદ થતો ત્યારે, હંજનું પ્રજનન મોટાં રણમાં થઈ શકતું. આજાઈ બાદ, કચ્છમાં નદીઓ પર બંધાયા. લુણી પર પણ બંધ બાંધવામાં આવ્યો. આ તરફ બનાસ નદી પર પણ બંધ છે. આના પરિણામે, રણમાં નદીઓ દ્વારા વરસાદી પાણીના પ્રવાહમાં મહદું અંશે ઘટાડો થતો આવ્યો છે. હવે હંજના પ્રજનન માટે અનુકૂળ પાણીનો ભરાવો માત્ર એ જ વર્ષોમાં થાય જ્યારે ભારે વરસાદ પડે અને ઉપરોક્ત બંધો છલકાય. જ્યારે કચ્છના ઠુંગરો પર અતિ ભારે વૃષ્ટિ થાય ત્યારે અમુક સંખ્યામાં હંજ બચ્યાં ઉછેરે છે. નજીકના ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે, હંજે ઈંડાં મૂક્ખાં જેમાંથી બચ્યાં નીકળ્યા બાદ, પૂરતા પ્રમાણમાં પાણી ન હોવાથી ખારાશ વધવાની સાથે પાણી પણ ઝડપલેર સૂક્ષ્વાના માંંયું, તેથી એ પક્ષીઓ તેમની વસાહત છોડી ગયાં અને મોટી સંખ્યામાં બચ્યાં મરણ પાય્યાં. હાલનાં અમુક વર્ષોમાં એવું પણ બન્યું છે કે, ઈંડાં મૂક્ખાં બાદ તત્ત્વ જ પાણી સૂકાઈ ગયું અને એ ઈંડાં જેમના તેમ રહી ગયાં હોય.

કચ્છના મોટાં રણના છેવાડાના પણ્ણિમ ભાગમાં લગભગ બે દાયકાથી સિંધમાંથી પાણી છોડવામાં આવે છે, જે એક નાળા વાટે રણમાં એકહું થાય છે. જ્યારે મોટાં રણની મુખ્ય વસાહતની જગ્યા સૂકાઈ જાય ત્યારે હંજ પણ્ણિમ ભાગમાં એકઠાં થાય છે અને ભારત-પાકની રણ-સીમા પાસે માળા બાંધે છે. અહીં પણ ૧૯૮૮ના દાયકામાં એક વર્ષ, બચ્યાંના પીછાં ઉગ્યા હતાં, પરંતુ તે બીડવાલાયક થાય તે પહેલાં પાણી સૂકાઈ ગયું અને પાણી અને ખોરાકની શોધમાં એ બચ્યાં આમ તેમ ચાલીને રખડાંયાં બાદ મરણ પાય્યાં. એ સમયે લગભગ બે થી ત્રણ હજાર આવાં બચ્યાં મરેલી હાલતમાં આપણા લશ્કર અને સીમા-સુરક્ષાદળના જવાનોને જોવામાં આવ્યાં. આ જાતની પરિસ્થિતિ ફક્ત આપણા રણમાં જ સંભવ છે તેવું નથી. વિશ્વમાં જ્યાં જ્યાં હંજનું પ્રજનન થાય છે ત્યાં આ પ્રકારની હાલત સમય પર નોંધાયેલી છે.

હું તા. ૭-૧-૧૯૮૮ના દિવસે મોટાં રણમાં ગયો હતો. જ્યાં સિંધમાંથી પાકિસ્તાન રણમાં પાણી છોડે છે, ત્યાં આપણી સીમાની છેલ્લી ચોકી પાસે ૮૦૦ અથવા તેથી થોડા વધારે નાનાં હંજ હતાં. આ પૈકી ૪૦૦ જેટલાં બચ્યાં હતાં. તેમાંના ૨૦૦ પક્ષીઓના કદ વધારે નાના અને ભૂરો રંગ વધુ વેરો જણાયો હતો. કોઈ નજીકની માળાવાળી

વસાહતમાંથી તે આવ્યાં હોય તેવી શક્કતા નકારી ન શકાય. કચ્છના મોટાં રણના આ છેવાડાના દિસ્સામાં જીજાવથી સર્વેક્ષણ કરવાની જરૂર જિન્હી થઈ છે. બન્ને દેશો વચ્ચેના સંબંધો ન સુધરે અને સીમાની બે તરફ રણમાં બન્ને દેશોના પક્ષીનિષ્ણાતો ન જઈ શકે, ત્યાં સુધી એ સર્વેક્ષણ કરવું શક્ય નથી.

હાલના સમયમાં બહુ મોટી સંખ્યામાં હંજ રણમાં એકઠાં થતાં નોંધાયાં નથી. કુલ લગભગ વીસ હજારની આસપાસ આ પક્ષીઓ પ્રજનન માટે આવે છે. પરંતુ અહીં એક રસમદ સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આ પક્ષીઓને મોટાં રણમાં કોઈ ચોક્કસ સમયે પહોંચવાની માહિતી કેવી રીતે મળતી હશે? નિયત સમયે, જુદી જુદી દિશાઓમાંથી આ પક્ષીઓના નાના મોટા સમૂહો, રણ તરફ ઉક્ષયન કરતા જોવા મળે છે. હવામાનમાં થતાં ફેરફાર યા વાતાવરણના બેજને આધારે તેમને કોઈ પ્રકારના સંકેત મળતા હશે? આમ જોઈએ તો, હંજ સ્થાનિક નિવાસી તરીકે છૂટાછવાયા આવે, છે. ડૉ. સલીમ અલી અને ડિલની રિપોર્ટ ('હેન્ડબુક ઓફ ધી બર્ઝ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન', પ્રંથ ૧) જ્ઞાનાવે છે, ઉત્તર ને પૂર્વ આફિકા ઉપરાંત, દક્ષિણ યુરોપમાં સેન, ફાન્સ, ઇત્યાદિ અને કાસ્પિયન પ્રદેશથી પણ સાઈન્સિસ અને તેથી દક્ષિણમાં અફઘાનિસ્તાનમાં હંજ નોંધાયાં છે. એ બધા પ્રદેશો અને ભારતીય ઉપખંડ વચ્ચે આ પક્ષીની કેટલી અવર જીવર રહે છે, તે હજુ નક્કી થયું નથી. એક પક્ષી થાંજવુરમાં મળી આવ્યું જેના પગ પર ઈરાનમાં પહેરાવેલ કરી હતી. તેથી જ તો આ લેખની શરૂઆતમાં મે કહું છે કે, ભવિષ્યમાં જ્યારે હંજ બચ્યાં ઉછેરે ત્યારે, તેમના પગમાં કીઓ પહેરાવવી જોઈએ જેથી આ પક્ષીના સ્થળાંતર વિશેની માહિતીની ખૂટી કરીએ મળી રહે:

### About Unusual Observations

Dr. Bakul Trivedi,

I serve you this time with a gallimancy of several subjects in English which kindly publish in original form. You may certainly provide a Gujarati translation side by side for the benefit of those readers who may not be quite conversant with the English language. I might mention here that the catalyst for this exercise are that remarks of my respected good friend Lavbhaji. I

can not lay claim to the lucidity and expression of the English prose of Lavkumar Khachar.

Lavbhai's remarks about Shantilal Varu's reporting the Scarlet Minivet's occurrence in my 'wadi' sent me in a flat spin of doubt about my correctly identifying the bird. The Scarlet Minivet and the Longtailed Minivet are certainly very similar in appearance and judging from the date apparently mentioned, the assertion of Lavkumar would be correct. I have not read Shantibhai's note, but the bird concerned was first heard calling and was subsequently seen by me on December 25, 1980. I again saw it on January 30, 1981, February 3 and again a female on November 30 the same year. Could it be the same bird? On referring to my field notes I find that I described the call of this minivet as whee - tweet or twee - tweet which synchronizes with the call notes described on page 242 of 'The Book of Indian Birds' (12th Edition). The bird I saw also had a monosyllabic pleasant whistling note. On the other hand on the same page in species sl. no. 389 the call of *P. ethologus* is described as 'a finch-like djib-djib and tit-like chatter when flying along the tree tops!'

Whenever I come across any rare or accidental bird in my grounds I call over my birdwatcher friends to see it. When mentioning unusual or rare birds it is always advisable to give a reference. In the above case Shantibhai should have mentioned Vol.79, No.1, April 1982, in brackets, for my note on the occurrence of the Scarlet Minivet was published in that volume of the Journal of 'Bombay Natural History Society'.

In the above context I may mention here that, over the years experience has taught me that birds do turn up where they are least known or expected to do so and what is taken to be impossible becomes possible against all the rules of the game! In recent times the Goldenbacked Woodpecker (*Dinopium benghalense*) was seen in the Vijay Vilas Palace garden (Mandvi) and a Green Pigeon (Yellowlegged Green Pigeon, (*Treron phoenicoptera*) was recorded in Mata-na-mad, Lakhpat Taluka. How these species came in to

Kutch is still a matter unexplained.

I am here reminded about the anecdote concerning the occurrence of the Haircrested or Spangled Drongo (*Dicrurus hottentottus*) in which both Lavbhai and I were involved. Darbarsaheb Shivrajkumar and Lavkumar paid me a visit in the year 1956. We did some birding in Kutch and while relaxing in my house in between the outings, we used to discuss our experiences and exchanged views. Lavbhai expressed his desire to see my bird notes. Accordingly I showed him my haphazardly kept notes from which he made a list of those occurrences that appeared interesting to him. Among the birds listed was the Haircrested Drongo seen by me in the Vijaya Vilas Palace garden in 1947-48. On returning to Jasdan, Lavbhai prepared a note based on my observations which was published in the Journal of 'Bombay Natural History Society'. Apparently many expert eyebrows were raised on the mention of the said drongos occurrence in Kutch, for Kutch was the least likely place for seeing this species. Lavbhai got good and proper reprimand from his 'guru' Dharmakumarsinhji for publishing someone else's notes which mentioned a bird that could not occur in Kutch! It so happened that during one of my yearly winter visits to Mandvi some time after the publication of the above note I again came across *Dicrurus hottentottus* in the Vijay Vilas plantation and I collected a specimen and sent it off to the B.N.H.S. Some time prior to this, when he visited the society, Dharmakumarsinhji was strongly and emphatically discussing my impossible claim of recording the Haircrested Drongo in Kutch with Humayun Abdulali. Soon after that the specimen collected by me reached the Society's premises! Humayun described this episode to me when I met him. Thus 'lady good fortune' smiled on Lavbhai and me, for we were vindicated, he in quoting me and I in having claimed to have seen the species where it could never occur!

29-8-2001

Jubili Ground, Bhuj 370001

(To be continued...)

## અભિપ્રાય


### Call of Indian Birds ઓડિયો કેસેટ

(પ્રાપ્તિકાળ : ૮૧, સર્જનસ્થાન, અદવા માઈન્સ, સુરત ૩૬૦૦૦૭)

બાઈબલમાં લખ્યું છે કે, “સૃષ્ટિના સર્જનના છઢા દિવસે, ઈશ્વરે પોતે સર્જેલી દરેક વસ્તુ ફરી ચકાસી બધું જ સુંદર છે તેવો સંતોષ વ્યક્ત કર્યો.” ‘સુરત નેચર ક્લબ’ દ્વારા બનાવાયેલી પક્ષીઓના અવાજની ઓડિયો કેસેટ ૬૦ મિનિટ સાંભળ્યા પછી, કંઈક આવો જ ભાવ મને થયો. સાંભળી લીધા પછી આંખો બંધ કરીને હું લાંબો સમય બેસી રહ્યો અને એ અવાજની ગુંજ માણસો રહ્યો. ખરેખર, ખૂબ સુંદર !

થોડા દિવસો પછી કેસેટનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા મેં, તે ત્રણ વખત સાંભળી. કદાચ હું મોટો સંગીતપ્રેમી નથી, પણ ઊંચી ગુણવત્તાવાણું સંગીત રેલાય તો ઉત્તેજિત થઈ જતી મારી સંવેદનાઓ, ઉપર મને વિશ્વાસ છે. જે પછી પક્ષીઓના અવાજ ‘રેક્રડ’ થયેલા છે તેમાં એક પણ અજુગતો કે સંદિગ્ય નથી. તેમાંના ત્રણ હું સામાન્ય કક્ષાના ગણું છું જ્યારે બાડીના પપ અવાજોનું ‘રેકોર્ડિંગ’ ઊંચી કક્ષાનું છે. કુલ ૧૬ અવાજોના રેકોર્ડિંગમાં પાછળ બીજાં બે-ત્રણ પક્ષીઓના કલરવ પણ આવી ગયા છે. પશ્ચાત ભૂમિકામાંથી આવતાં અન્ય પક્ષીઓના અવાજથી મૂળ પક્ષીના અવાજમાં જરા પણ અવરોધ ઉભો થતો નથી. ત્રીલટું, વધુ નૈસર્જિક વાતાવરણ ઊભું થાય છે. ૧૩ અવાજોમાં પાછળ મશીનની ઘરેરાઠી (Humming) સંભળાય છે, જે આવકાર્ય નથી. મારી દસ્તિએ ૨૬ અવાજો કોઈ પણ વિક્ષેપ વિના એકદમ સુંદર રેક્રડ થયા છે. વધારાના આકારણમાં કેસેટનું સુંદર આવરણ અને તેની સાથેની નાની પુસ્તિકા છે જેમાં બધાં જ પછી પક્ષીઓના રંગીન ચિત્રો છે.

જો યાંત્રિક કુશળતાની દસ્તિએ સંપૂર્ણ કહી શકાય, તેવું રેકોર્ડિંગ હોય તો તે, નીલકંઠ (Bluethroat) નું એકદમ શુદ્ધ અને નિર્ભણ, સીધો આકાશમાંથી ઉત્તરી આવ્યો હોય તેવો અવાજ ! કુંજના અવાજથી ઘરીભર આંખ સામે, ખેતરોમાં ટોળાબંધ ભેગી થયેલી કુંજનું દાખ ઊભું થઈ જાય!



કુંજના ઊરી જતાં ટોળાના વૃદ્ધગાનથી રચાયેલી સંગીતરચના દિવ્ય લાગે છે. (જો કે, મને એ શંકા છે, આ કરકરાનો અવાજ તો નથીને ?)

સોનેરી લક્કડાખોદ (Lesser Goldenbacked Wood pecker)ના સ્પષ્ટ છતાં પ્રતિધોષિત અસરવાળા વિલંબિત અવાજથી, તે એકદમ જુદો તરી આવે છે. અકર્માત હોય કે ગોઠવણી, પણ સરસ અસર ઊભી થાય છે.

‘નેચર ક્લબ’, સુરતને ખૂબ ખૂબ અભિનંદન ! આટલું સુંદર સર્જન અને તે પણ ફક્ત ૧૨૫-૦૦ રૂ.માં ! મને ખાત્રી છે કે, જો આ કેસેટની જાણ વ્યાપક રીતે સૌને થશે તો તેની ઘડી બધી આવૃત્તિઓની જરૂર પડશે. પ્રકૃતિ પ્રેમીઓ, ‘નેચર ક્લબ’, સુરતના આ પ્રયાસને વધાવી લે એટલું જ નહીં, તેમને પ્રોત્સાહિત કરે અને કેસેટના બીજા ભાગની જોરશોરથી માંગણી મૂકે તેવી હું આશા રાખું છું.

જન. વલાજિતાસિંગ  
અનુ. ડૉ. બહુલ ત્રિવેદી

